

SOUTH AFRICAN PUBLIC LIBRARY
10 AUG. 1954

No. 30—Vol.—LII

FRIDAY,
6TH AUGUST, 1954

Registered at the G.P.O. as a Newspaper

Price 6d.

INDIAN OPINION

Founded by Mahatma Gandhi in 1903

The Smoking Habit

I have a horror of smoking as I have of wines. Smoking I consider to be a vice. It deadens one's conscience and is often worse than drink in that it acts imperceptibly. It is an expensive vice. It fouls the breath, discolours the teeth and sometimes even causes cancer. It is an unclean habit.

I have always regarded the habit of smoking as barbarous, dirty and harmful.....I cannot bear to travel in a compartment full of people smoking. I become choked.

Cigarette smoking and coffee and tea drinking.....are not necessities of life.....Some.....take 10 cups of coffee a day. Is it necessary.....for keeping them awake for the performance of their duties? If that is so, let them not drink coffee or tea but go to sleep. We must not become slaves to these things... Cigars and cigarettes, whether foreign or indigenous, must be avoided. Cigarette smoking is like an opiate and the cigars that you smoke have a touch of opium about them....How can you foul your mouth by converting it into a chimney?.....A drunkard in Tolstoy's story is hesitating to execute his design of murder so long as he has not smoked his cigar. But he puffs it and then gets up smiling and saying, 'What a coward am I,' takes the dagger and does the deed. Tolstoy spoke from experience. He has written nothing without having had personal experience of it. And he is much more against smoking than against drink. But do not make a mistake that between drink and tobacco, drink is a lesser evil. No. If cigarettes is Beelzebub, then drink is Satan.

—Mahatma Gandhi.

(From Vol. 1, Gop'n'ti Desai's
'A Gandhi Anthology')

NARROW NATIONALISM

WE are indebted to the secretary of the Coloured People's Council of Action for the following extract taken from a speech delivered by the late Dr. A. Abdurahman, in the City Hall, Cape Town, when he addressed a mass meeting of Coloured People who had assembled to protest against The Franchise Amendment Bill of 1931. It is printed here because time has not changed the significance of what he said then, and few today could say it better:

"Since Union there is no longer co-operation between White and Coloured in the Cape Province, and while we have tried to bring back that spirit at non-European Conferences, the Government is plainly determined to build up a nation which excludes all non-Europeans. Unfortunately, Nationalists do not comprehend the meaning of the term "Nation." They believe that it could consist of a small racial section to the exclusion of everybody else. They are too stupid to understand that a nation may consist of more than one race, have more than one language, and may follow more than one religion. There is but one essential for the building of a nation, namely, the feeling of comradeship and interdependence and the spirit of loyalty to one's country. With such a feeling and such a spirit there is hope of everyone attaining a higher life according to his capacity. This is exactly what the Nationalists do not want. They are trying to build up a nation exclusively out of a narrow, bitter, racial section. Even English-speaking White South Africans are pushed aside, and, of course, Natives and Coloureds must be kept in bondage. But they are bound to fail if all who are excluded stand together. If the Nationalists do not change their attitude towards non-Europeans, then one day someone, despite the Riotous Assemblies Act, will consolidate the inherent power which lies in the industrial workers, direct it and burst the chains which withhold from us that status to which all free men are entitled. Possibly the English-speaking Whites will also wake up and defend their rights before it is too late, surely they will, before abandoning all hope.

"The stupid Nationalist Government should be reminded that even in South Africa it is impossible to reverse the order of things, that they cannot hope to govern unjustly for any lengthy period the non-Europeans, that unless they win the affection and loyalty of our people, unless they demonstrate that they are governing the country in the interests of all, disaster will overwhelm them."

Today, of all days, the joy of giving is uppermost in every heart. The best thing to give to your enemy is forgiveness; to an opponent, tolerance; to a friend, your heart; to your child, a good example; to your father, deference; to your mother, conduct that will make her proud of you; to yourself, respect; to all men, charity; and to your loved ones?

Surely a **NEW INDIA PROTECTION POLICY**,
the best of all Gifts.

THE PLEASURE OF GIVING IS YOURS, AND THAT OF SERVING YOU IS OURS.

The
New India Assurance
Company Limited

(Rustomjee (Pty.) Ltd. Principal Controlling Officers)

74 VICTORIA STREET,

DURBAN

Telephone 2335. Telegrams 'BRADFORD'

P.O. Box 110

LUSAKA, NORTHERN RHODESIA

**BRADFORD CLOTHING
FACTORY**

Direct Importers and
Wholesale Merchants

Clothing Manufacturers

Proprietor RAMBHAI D. PATEL


Branch:

CITY STORE

Cairo Road, Lusaka

Always in Stock:

Piece Goods, Hosiery, Cutlery
Enamelware, Stationery, Drapery,
Crockery, & Wool.



B. I. S. N. Co. Ltd.

S.S. Karanja arriving August 28. Sailing September 3
for Bombay via Karachi and Forebunder.

Passengers must conform with the Cholera Vaccination and Yellow
Fever inoculation requirements and obtain certificates from their
nearest District Surgeon. Inoculation by and certificates from
private Medical Practitioners will not be accepted.

FARES : DURBAN TO BOMBAY

First Class	single	without	food	£83-10-0
Second "	"	"	"	55-0-0
Inter-Class	"	"	"	37-0-0
Unberthed (Deck)	without	food		24-10-0

Muslim Special Food £11-10-0 Ordinary Food £4-17-6
Hindu Special Food £10-3-0 Ordinary Food £4-5-6

Bookings for 1st, 2nd, Inter-Class and Unberthed (Deck) can
be effected by communication with us by telegram or letters.

Under no circumstances will unberthed passengers be
permitted to keep on deck with them more than one bed-
ding roll and one trunk for use during the voyage.

For further particulars apply to—

SHAIK HIMED & SONS (PTY) LTD.

390 PINE STREET, Telephone 20432, DURBAN.

Tel. Add. "KARAMAT."

INDIAN OPINION

FRIDAY, 6TH AUGUST, 1954

Dr. Malan Again

SOME people die just out of fear of disaster before the disaster actually comes. Such is the pitiable state in which our Prime Minister, Dr. Malan, appears to be today. He has once again come out with an outburst against Mr. Nehru, the Prime Minister of India. He seems to be haunted by the African and the Indian. It reflects his and his Government's guilty conscience. We are happy to note, however, that Dr. Malan has at least one complimentary word to say about Mr. Nehru and that is about his outspokenness. That is a very important point. It proves that there is no duplicity about the Prime Minister of India as is characteristic of the present day statesmen who have imperialistic designs. There is no secrecy about Mr. Nehru. He is quite straightforward and says what he exactly means and does what he says. Time and again he has denied the charge laid against his Government having any designs in foreign countries. One thing about him is that he does not turn a deaf ear to the cry of the oppressed people, wherever it may come from. He listens to it and does everything in his power to bring relief to them. Apart from that he is concerned with nothing. If that hurts the oppressor, who is obsessed with power and desires to reign supreme unconcerned about the feelings and sentiments and the legitimate ambitions and aspirations of the people

whom he keeps crushed under his iron heel, and claims to have God-given right to do so, it is no fault of Mr. Nehru, who sees things purely from a humanitarian point. Far be it from us to desire to give undue credit to Mr. Nehru, who has his human weaknesses just as all others have. He has never claimed to be a saint nor does he ever claim, as some people in South Africa do, that he or his people are the chosen ones of God and the rest who are not of their colour are barbarians or semi-barbarians destined to remain for ever their slaves. So truth, justice and righteousness are on Mr. Nehru's side and it is because of that that he has nothing to hide and is able to stand abreast before the world and to say fearlessly what he thinks and believes to be true.

Greatest Sin

The greatest sin of Mr. Nehru, according to Dr. Malan, is his anti-colonialism. Applied to Africa it means—so says Dr. Malan—the White man must quit Africa. It can mean this only if the White man adopts an ass-like attitude and insists on remaining unbending in regard to his wholly unreasonable, unjust and immoral desires. Nobody wishes it to be so; everybody prays that it may not be so. If, notwithstanding, the White man has to quit he alone will be to blame.

What constitutes "domestic affairs" of a country will

have to be decided. From a commonsense point of view, when a very small minority assumes unto itself the power to misrule a vast majority without the consent of that majority the ruling minority cannot by any canon of justice claim it to be its "domestic affair."

Law-Breaking

Dr. Malan charges Mr. Mr. Nehru of encouraging law breaking. "Proof of this is his public appeal to Indians in South Africa to join forces with the Natives in a mass resistance movement," he says. One of the traits of Hitler was said to be to repeat a lie over and over again to render it acceptable as truth. The Communists are now credited with the same trait. Surely Dr. Malan has not got the infection! Mr. Nehru has never made such an "appeal" to Indians. What he did say was that the Indians should not ask for preferential treatment to the detriment of the Africans. Mr. Nehru has never given any guidance as to how the resistance movement should be carried on in this country. He has certainly blessed any struggle conducted on non-violent lines for justice and righteousness. And Mr. Nehru need not be singled out for doing that. If old age and infirmity has not had a detrimental effect on his memory Dr. Malan will perhaps remember, what we still remember so vividly, that in 1913, when the Indian community was engaged in a Passive Resistance struggle, led by Mahatma Gandhi, against unjust and immoral laws of the then Union Government, it was Lord Hardinge, the then Viceroy of India, who had condemned in unmistakable terms the policy of the Government and had

openly blessed the struggle and funds were collected in India to support the struggle. It may be said to the credit of the Union Government of that day that it was not as hard-hearted as the present one, which seeks to close all avenues of support coming from outside in order to strangulate the people who are opposing it.

Portuguese Possessions

Dr. Malan gleans over Anglo-Egyptian "friendship" and over the strained relations between the Portuguese and the Indian Governments. He talks of "our Portuguese neighbours with whom we live so happily and peacefully." We know all about that. We know what inroads the Union has made so subtly in Portuguese territories. It is not our purpose to discuss that here. What we wish to say is that here again Dr. Malan has willfully misrepresented India and the Prime Minister of India, India is guilty of no act of aggression. This unfortunate incident between the Governments of India and Portugal is deeply regretted. It is to be hoped and prayed that it is just a temporary phase which will soon pass away, that the mists of misunderstanding will be removed and that both the Governments will remain friends as they have always been in the past. The position of the foreign possessions in India is very similar to that of the British Protectorates in the Union. The difference is only this that while the Union Government is clamouring for the Protectorates to be merged with the Union it has not succeeded in acquiring the consent of the people that count of those Protectorates. It is only the small White minority

collaborating with the White rulers of the Union who is asking for the merging of these Protectorates with the Union, while the vast majority of the Africans are not consulted in the matter and they have expressed their unwillingness in the most emphatic terms. The Union Government has not dared to take a referendum of all the people because it knows that it would go against it. The position in regard to the small Portuguese possessions in India is that they are there in name only. They have made no progress whatever in all these years. Beyond perpetrating evil in the form of illicit traffic in liquor which is prohibited in India, and other goods, they are practically of no value. Besides it is the desire of the vast majority of the inhabitants of those foreign "Pockets" which are hardly

distinguishable from India to merge with India. The Portuguese Government has thereby nothing much to lose materially. On the other hand it gains the goodwill of four hundred million people, which is far more valuable. We only hope the Portuguese Government and the people will not be lured by Dr. Malan's Juda's kiss.

We have always had respect for Dr. Malan. "Better an enemy you know than a friend you do not know." Dr. Malan is an enemy we know, because he has always been quite frank and open in his dealings with the non-Europeans. We feel pity for him that in the eve of his life he should betray such a lack of faith in God and begin to worship mammon. For that is the meaning of the monster of "Whiteism" which seems to have got a mortal grip over him.

CANON COLLINS

THE following letter was sent to 'The Star' (Johannesburg) but the paper did not see its way to publish it.

As an Anglican layman who first met Canon Collins in 1938, I hope on some later occasion to discuss his views on our racial questions, and the frenzy of disapproval they have occasioned, more fully and dispassionately than is possible in a letter. Here, I just want to protest against the statements of a prominent Anglican clergyman

The Archdeacon of Port Elizabeth has said that (1) Canon Collins was not invited to the Union by the Anglican Church and that he speaks only for himself; (2) that undue publicity has been given to his visit; (3) that his views have "dismayed those who are doing the spade work in this country;" (4) that he should prove his sincerity by accepting a missionary appointment here; (5) that "he is regarded as a scholarly crank in educated Church circles in London;" (6) that "perhaps he prefers the amenities of Amen Court to the difficulties of the b.ndu."

(1) is not disputed, except by a section of the Afrikaans press and the Moderator of the Ned. Herv. of Geref Kerk who suggests using "the deplorable statements of a responsible spiritual leader of one of the largest Churches taking part" as an excuse to call off the conference between European and non European Church leaders that the Dutch Reformed Churches proposed to convene later in the year. We must all hope that more courageous and relevant counsel will prevail.

(2) is hardly the fault of Canon Collins, who has been much more sought after than seeking. (5) and (6) border on the abusive. Personal decigration hardly advances Archdeacon Powell's case. (4) opens up entertaining vistas not only of a flood of immigrant-critics settling in this country, but of the emigration of the Cabinet, the Nationalist Party and the editorial staffs of the Government press to the Gold Coast, Nigeria, Kenya, Uganda and C.A.F.

(3) raises issues of much greater importance. Writing from a parish which, several years ago,

not merely stopped its monthly inter-racial service but even forbade the use of its church building for separate non European services and which today is attempting to meet a fresh challenge to practise the faith it professes by re affirming and re justifying that decision. I must question whether my Church is, in fact, doing enough spade work on our most insistent moral problem. I know that there are honourable exceptions among both clergy and laity, and that a few parishes do not conform to the general pattern. But, by and large throughout the length and breadth of South Africa, the Anglican Church fails to bear practical, living witness to the unity of all Christians in Christ, here and hereafter, which it theoretically acknowledges and very admirably proclaims. By our deeds, not our words, shall we be judged.

And I do not believe that we can excuse this failure on the several expedient grounds that are usually urged. The Gospel of Jesus gives singularly little

comfort to those who seek to reconcile expediency and conscience where basic spiritual and moral principles are at stake. Nor is the contention acceptable that, imperfect as we are, we Anglicans constitute the spearhead of a more liberal interpretation of the Christian ethic in South Africa. For, on this issue of colour, several other communions from whom we differ deeply on theology and doctrine—most notably, the Roman Catholics—are daily practising what we preach but fail to observe.

If, therefore, Canon Collins' visit has really "dismayed" Anglicans and led some to search their consciences, this would be a cause for rejoicing among followers of Him who brought, not peace but a sword. Does Archdeacon Powell's vigorous disapproval of the Canon perhaps derive from some inner recognition of truths stated, but too seldom faced in our daily life?

Your etc, C. W. M. GEL'.

WANTED ALIM

Wanted a Alim having certificates of Hafez, Kari and Molvee to serve as Imam in Heidelberg Mosque and Teacher in Madrasah. Monthly salary £25. Lodging, water and lights free. Annual increment according to work.

Apply with testimonials to Heidelberg Muslim Jamat, P.O. Box 60, Heidelberg, Tvl.

Golden Jubilee Number

Those subscribers who did not receive a copy of Phoenix Settlement Golden Jubilee Number and wish to have one may do so by kindly sending their subscription.

All Postal Orders should be made payable to 'Indian Opinion', P.O. Darban, not Phoenix.

BONES WANTED

We Pay
£7 PER TON
F.O.R. your
Station or Siding

BAGS RETURNED RAILAGE PAID

For Full Particulars write to:

THE
**BULLBRAND
FERTILIZERS LTD.**

SARNIA,

NATAL.

DR. MALAN ON ANGLO-EGYPTIAN AGREEMENT AND INDIA

THE Anglo-Egyptian agreement would introduce a new friendship with Egypt which would contribute much to safeguarding the Arab States from the Russian and Indian spell or threat, or both, to which they were now exposed, said the Prime Minister, Dr. D. F. Malan, on Sunday, August 1 in an interview with Sapa.

Asked why he spoke of India in connection with the Middle East situation, Dr. Malan said it was "noticeable how Mr. Nehru parades as the leader of the Arab States just as he does in regard to the whole non-European world."

"You cannot at present mention Africa without being reminded of Mr. Nehru," he said.

Dr. Malan said Mr. Nehru was not only a danger for Africa in general "but more particularly also for us." If we and the world do not yet think so, then it is certainly not his fault.

Dr. Malan said the fortunate thing about the Indian Prime Minister was his outspokenness.

"He knows where he wants to go and even in regard to the methods by which he hopes to achieve his ends, he leaves no doubt," Dr. Malan said.

Asked to explain more fully, Dr. Malan said Mr. Nehru's statements as confirmed by his actions are capable only of one interpretation.

"His express policy in his so-called anti colonialism. Applied to Africa it means that the four European Powers which have possessions in Africa—which in reality means the White man—must quit Africa. Practical steps in that direction are only openly encouraged by him.

"Established Indian communities in other countries are systematically used by him as spearheads to justify and prepare the grounds for his interference in their domestic affairs.

"Mr. Nehru does not even shrink from direct encouragement of law-breaking," Dr. Malan continued. "Proof of this is his public appeal to Indians in South Africa to join forces with the Natives in a mass resistance movement, and the collecting of funds for this purpose in India.

"This is all still fresh in our memory, and as we saw just a little over a week ago in connection with the meeting behind closed doors of non-European organisations, the matter has not at all ended.

"Against our Portuguese neighbours, with whom we live so happily and peacefully, Mr. Nehru allows open aggression in their lawful possessions close to the border of India."

Dr. Malan said he hoped that these acts of Indian aggression against Portuguese possessions would serve to bring South Africa and Portugal closer together in matters of common interests and common dangers.

Dr. Malan was asked if, apart from Mr. Nehru's aims and activities in Africa, there were any other signs of danger from the Indian Prime Minister.

He said there was none except in so far as Mr. Nehru had given an indication of what "we and the world can expect in the future. Mr. Nehru has said there are only four countries that can determine the future of the world. These are India, China, Russia and the United States of America.

"In other words, with him the whole of Central and Western Europe, including Britain, do not count at all. And just imagine, this is the cradle of the White races and the Western civilisation which they gave to the human race to the good of the whole world.

"What this prospect can mean for us we can realise if we remember that India and China like Australia, New Zealand and South Africa have their borders on the same ocean waters.

"Our greatest danger might eventually lie in that direction and our defence policy should therefore take this into account. We may not neglect our East Coast and adjoining seas.

"The anti-Communist countries in the North Pacific Ocean have found it necessary to enter into a mutual defence agreement with one another, and we shall have to consider the need for a similar agreement which will include like thinking countries in and around the Western Indian Ocean and their responsible mother countries."

Dr. Malan was asked what South Africa's position would be in the event of a new world war particularly in regard to the defence of the Middle East. He said South Africa's "well known policy in this regard must, of course, in our own interest, remain unaltered.

"But, in my opinion, it is only right and fair that it should be

supplemented in view of South Africa's particular circumstances as outlined by me so far.

"If we declare our willingness, as we do, to render assistance to others, then surely we also have the right to demand for ourselves the same protection which is enjoyed by the others.

MR. MALHAUTRA SAILS FOR INDIA

MR. J. L. MALHAUTRA, assistant Secretary to the High Commissioner for India in the Union of South Africa sailed for India by the Kampal, on Monday. There was a large crowd of Indians present at the wharf to bid him farewell.

On Thursday night, July 29, Mr. Malhaura arrived in Durban by car from Johannesburg. He had farewell receptions given him on his way at Ladysmith, Dundee and other places and several functions were held in and around Durban during the weekend.

The Natal Indian Congress had arranged a farewell function in honour of Mr. Malhaura at first at the Gandhi Hall, Lorne Street, at 8 p.m. on Monday, August 2. The officials of the N.I.C., however, got to know later that the boat was sailing on Monday and not on Tuesday and so the previous arrangement had to be cancelled and a reception was arranged at the Durban International Club at 4-30 p.m. on Sunday afternoon. It was not possible owing to the shortness of time to reinform all those who had been invited previously, of the new arrangements, and so the public was left in confusion and a much smaller crowd than had been expected was present at the Club. Nevertheless the Club Hall was filled to capacity. The Durban and District Women's League headed by Mrs. Mkizi, Miss Fatima Meer and others served tea, cakes and light refreshments to all those present.

The meeting commenced after tea. Dr. G. M. Naicker, president of the Natal Indian Congress, took the chair and was supported on the platform by Mr. Malhaura, Mr. Yengwa, secretary African National Congress, (Natal), Mr. Fredricks, of the Coloured Association, Mr. Lal Hen, a member of the staff of the Indian High Commissioner's office and Mrs. Mkizi.

Mr. Malhaura expressed his thanks for the very kind sentiments expressed by the president and the other speakers in regard to India, the Prime Minister Mr. Nehru and himself and said that during the five years he had spent in South Africa he was very pleased with the progress

"And if the North Atlantic Treaty give that military protection to those who, like ourselves, are part of the defence of the Middle East against the Communist danger, then that protection should also be accorded to the same extent to South Africa."

—Sapa.

his own countrymen had made. In the beginning the Indians thought just of themselves but now they were identifying themselves with the non-Europeans and had made common cause with them.

Mr. Malhaura said, the creators of apartheid were becoming demoralised because there was very little morality about it.

"The rulers of this country have built up a structure in which the White man is superior," said Mr. Malhaura. "Because the Indians have fought this evil they have been regarded as alien and disloyal.

"It has been claimed that South Africa is a democracy. It is an essential of democracy that when a certain section is elected to power it must do things in the interest of South Africa. If it does not do so it will be denounced by those people who have not been elected.

"In passing laws in South Africa the argument has been put forward that White civilisation is being protected. In South Africa White civilisation means White supremacy which is being nurtured on hatred, fear, bigotry and narrowness. Civilisation built on these false ideas must decay.

"The idea that a man with a White skin is superior is being rejected in the outside world. The denial of rights to people is not based on love; it is based on force which is the law of the jungle."

Mr. Malhaura said he believed the Government was aware that the forces of righteousness were triumphing against the forces of evil and that they would soon have to give up their policy of Apartheid.

Mr. Malhaura said it was very difficult for an Indian from India to live in this country under the present set up of things but his (Mr. Malhaura's) life was rendered happy owing to the affection he was privileged to enjoy from all sections of the people including Indians, Europeans, Coloureds and Africans. He said he would carry with him very happy recollections of his stay in this country.

Mrs. Fatima Meer, wife of Mr. Ismail Meer, moved a vote of thanks.

NO EXCUSE FOR BAD MANNERS

'The Star' (Johannesburg) has the following interesting leading article in its issue of July 26:

FROM a political platform Mr. J. de Klerk, of the Transvaal Provincial Executive and a provincial election candidate who is also organising secretary of the Transvaal Nationalist Party, has permitted himself to refer to Mrs. Pandit as "daardie ou koeliemeid." Leaving aside the niceties of the Afrikaans idiom, there can be no doubt that these words were a grave discourtesy to an Indian woman who holds a high place among contemporary public figures.

Protests by readers of 'The Star' at Mr. de Klerk's statement will be echoed by many South Africans who disapprove of the Indian attitude to South Africa but are also jealous of South Africa's reputation in the family of nations. Whatever they may think of Mrs. Pandit's occasional utterances as a spokesman of her country, they will bear in mind the fact that she is a cultured personality who has played no small part in world affairs.

Mrs. Pandit has been Indian High Commissioner to the United States, she is the President of the General Assembly of the United Nations and she is mentioned as the next Indian High Commissioner in London. In her official capacities she has met and will continue to meet members and other representatives of the South African Government whom we may credit with sufficient understanding of what is required by the amenities of international intercourse.

That a leading Nationalist in the Transvaal should so far have forgotten himself as to use the vocabulary of the soap-box and the gutter about a woman of this calibre is a reflection on South Africa rather than on India or Mrs. Pandit. It is a glaring example of the type of loudness against which Afrikaner voices have been raised in the past and still more recently.

Church leaders and other public men have reason to deplore these signs of the degeneracy of the times, as a breach of the old Boer tradition of good manners towards the highest and the lowest.

In international relationships in particular it is essential that

South Africans whose words are likely to reach a wider audience should guard their tongues. When speaking of leaders of other countries they should do nothing to exacerbate feelings and at least remember the golden rule of doing unto others as you would wish others to do unto you.

'Cape Times'

Thus the 'Cape Times' dated July 22. We hope that Mr. J. de Klerk, General Secretary of the Nationalist Party in the Transvaal, has been incorrectly reported. Nothing would give the majority of South Africans greater relief than to hear that the report, which quoted him as referring to Mrs. Pandit, President, of the UN Assembly, as "daardie ou koeliemeid", was wrong. For the sake of South Africa's reputation as a civilized country where politicians possess at least elementary breeding and courtesy, the report, if wrong, should be denied immediately. Only harm could come to the Union if the impression were allowed to remain that a prominent official of the Government party had referred to one of the world's leading and most cultured women in this ignorant, ill-mannered and contemptuous way. It would have been bad enough if the alleged phrase were reported to have been used in some remote spot which the speaker believed to be cut off from communication with the civilized world and out of earshot of even the party leaders. But here we have a report which says that Mr. de Klerk called Mrs. Pandit "an old coolie woman" for the delectation of an audience in the midst of the rising industrial city of Vereeniging. Surely, it must be wrong.

The matter is drawn to official attention because leading members of the Government have shown themselves extraordinarily ax in the past in denying disgraceful expressions which have, apparently, been put into their mouths. Periods of up to nine months have elapsed before such notable persons as Mr. Ben Schoeman and Mr. Eric Louw have taken the trouble to refute reports of verbal vulgarity on their part. Mr. De Klerk does not hold high office in the Government, of course, but he is entrusted by the Nationalists

with a key political position, and statements attributed to him cannot be regarded as unrepresentative. His reported calling of Mrs. Pandit "an old coolie woman" will not harm the world-acclaimed reputation of that deservedly distinguished woman; but it will reflect great discredit on firstly himself, secondly on the Government of South Africa, and thirdly on all South Africans. What sort of impression must even our friends get of a people to whom a politician, seemingly, believes he can appeal by using the epithets of a guttersnipe? And that about a person whom the rest of the world regards as a flower of civilisation. The world is not likely to alter its standards of elegance to accommodate those allegedly displayed by Mr. De Klerk. As has been pointed out, the slur is not upon Mrs. Pandit. The slur is on South Africa—and we hope it can be removed, speedily.

*News the other papers
don't print
is to be found each week
in*

PEACE NEWS

World news—events in Africa, Asia, America, Europe—news of constructive peacemaking; race relations; progress towards a non-violent society.

Obtainable by air-mail each week from Britain at 50s. 6d. per year; sea-mail 21s.; 4 weeks trial subscription (sea-mail) 2s. 6d.

South African representative.

ELLA B. ELDER

Brownlee Street, Stutterheim, Cape.

London office:

3 BLACKSTOCK ROAD, N. 4

BOOKS FOR SALE

Key to Health—Gandhiji	1	6
Diet and Diet Reform—Gandhiji	5	0
Cleanings—Mira	1	6
Selections from Gandhi—N. Bose	10	0
Public Finance and Our Poverty Gandhiji	3	0
Hindu Dharma—Gandhiji	8	0
Bhoodan Yojna	2	0
Sardar Vallabhbhai Patel (Vol.1)—N. D. Parekh	16	0
The Diary of Mahadev Desai—V. G. Desai	12	0

Obtainable from:

**C/O INDIAN OPINION,
P. Bag, Phoenix, Natal.**

AFRICAN VIEWPOINT

LIBERAL PARTY CONFERENCE:

CONFUSION OF FUNCTIONS

By JORDAN K. NGUBANE

TWO features of the Durban conference of the Liberal Party were of especial importance to the African. The first of these was the Party's attitude to its relations with the movements for national liberation in the non-White section of the population. The other was the shift of emphasis on the franchise question. In the present article I propose to deal with the Liberal Party's relations with the African National Congress.

A point which seems to have worried the delegates to the Durban conference and which, incidentally, still gives certain Congressmen an unwarranted headache, is the compatibility of simultaneous membership of the African National Congress and the Liberal Party. To me it seems as if the people who crack their heads over this issue confuse the functions of Congress and the Liberal Party:

Congress stands for a specific set of political values. It so happens that these are values for which the Liberals also strive—the normal freedoms which we regard as part and parcel of the democratic tradition. From here the ways begin to part.

Congress, by its very nature, necessarily and rightly lays heavy emphasis on African interpretations of these values. It is the duty and main cause for existence of Congress to do this. That is why Congress has its own form of the colour bar (against enrolling non-Africans as members.) If it dropped this barrier at this stage, it would lose its right to express African interpretations of these values and, which would be more calamitous from the standpoint of Congress politicians, it would lose its representative character and influence in the African community and probably degenerate into a polyglot but impotent coterie like the All-African Convention.

From the perspective of retaining its representative character and influence, Congress is perfectly right in adhering to its own version of the colour bar in the prevailing circumstances. As long as we have exclusively white political parties striving to keep political power exclusively in white hands, we shall have no alter-

native but to have exclusive African bodies as well to educate the African on his specific responsibilities in the fight against race oppression.

The Liberal Party belongs to quite a different category. It exists as a bridge of accord between the conflicting nationalisms of the African and the Whiteman. It hoists the flag of racial tolerance and conciliation as against African reliance on the strength of numbers and the Whiteman's exclusive monopoly of political and military power.

To me these functions are quite different. The African National Congress is distinctly a nationalistic movement marching by an admittedly complicated series of left and right steps to the ideal of a society of free men. At one stage its policies are demonstrably influenced by its nationalistic wing, while at another they bear the unmistakable imprint of the men who wear the red tie!

The Liberal Party is not as yet hampered by this duality of approach. It marches—albeit timidly and half-heartedly—to the goal of a society of free men under the banner of racial conciliation. If dimorphic tendencies occur anywhere in its political outlook and practice, they spring from an unrealistic and futile yearning for a long-distance hand-shake with apartheid. This point will be discussed more fully in the next article.

The composition of the Liberal Party is a working guarantee that under no foreseeable circumstances will it develop into a heirenovolk party in the future. Congress's composition, on the other hand, is no guarantee—with due respect to the men of integrity who guide it at the moment—that given sufficient provocation it might not one day decide to campaign actively and aggressively for driving the Whites, the Indians and other "foreigners" into the sea.

This difference in the functions and potentials of the organisations is fundamental. It explains even the difference in their methods of agitation. To gloss over it by saying that simultaneous membership of both is compatible is to take up a wholly unrealistic attitude. Congress and the Liberals peddle two different varieties

of the same commodity. To say to the African that he would be wise to buy the two at one and the same time is to underrate his political intelligence, to say the least.

The positive point which should be emphasised at every stage is that the African who realises that the lessons of nationalism in Nazi Germany and in partitioned Ireland, Palestine and India exist for his guidance; who sincerely feels that he cannot take risks with a nationalistic movement which might one day put on totalitarian raiment (if the Verwoerds are not restrained in time); who sincerely accepts the creed of racial tolerance and conciliation and all this entails, should be quite free to join and work with like-minded Africans, Europeans, Indians and Coloureds in a political organisation and in an atmosphere where it will not be considered a virtue to apologise for the things he believes to be true and politically desirable.

In other words Liberalism should not be a creed for clandestine profession, away from frowning Congressmen. Its adherents have the right to proclaim it from any platform they like without allowing their zeal to be dampened by adverse Congress reactions. If they move about always with an eye on Congress they will soon find themselves in the vicious circle of running towards their goal while feeling chased by the Congress. Their strategy then will be to avoid being caught by Congress instead of marching straight to their declared goal.

On the other hand the African who is convinced that the numerical strength of his community is the only key to the solution of the race problem should be free to remain a Congressman. The active and continuous proselytization of people from one camp to the other and vice versa is a healthy and (to a true democrat) welcome concomitant of evolution to a society of free men.

Congress has no exclusive right to a monopoly of African converts to its creed. Nor does any organisation have it. It is as wrong and undemocratic for Congress—if and where it has said this—to insist that the Liberals should not be rivals with it for African members as it is for the Liberals to disclaim proselytizing intentions. Such conversions are of the very essence of a truly democratic society.

It is none of either Congress's or the Liberal Party's right to demarcate spheres of influence

on the conscience of the African. If the Liberals are convinced their creed will save South Africa from ruin, let them say so freely and be not afraid of winning converts from nationalism. If this weakens the African National Congress the fault will not be in Liberalism, it will be in Congress policies.

If, on the other hand, Congress is convinced that its brand of nationalism will save the country, let Congressmen say so without apologising for the converts they might win from the Liberal Party. If Congress attracts the African, the fault will be in Liberal policies.

It must always be remembered, of course, that neither the Liberal Party nor the African National Congress is judge in these matters. The African citizen is. Only he has the right to pass judgment on the programmes of either organisation. For this reason, neither should waste time demarcating spheres of influence on the mind of the African. They should girt their loins and get on to the battlefield without delay. It is their performance there which will qualify them for African support. The sooner we hear less said about rivalries for, or simultaneous membership the better will things be for all concerned. And, it must be noted, the things written here do not in any way suggest that Congress and the Liberals must not co-operate on matters of common interest. On the contrary, the underlying suggestion is that such co-operation must be based on equity, common sense and realism.

HINDU DHARMA

By— M. K. Gandhi

Price 8s.

Obtainable From:

'Indian Opinion,'

P. Bag, Phoenix.

Natal.

Cuticura
TALCUM POWDER

Tender skins are extra sensitive in hot weather. A dusting with Cuticura Talcum Powder cools the skin, allays chafing and ensures lasting comfort. Mother will just love its distinctive perfume and exquisite fragrance.

STOPS CHAFING!
549

THE

Provident Assurance Corporation of Africa Ltd.

Modern Life Insurance provides. . .

★ OLD AGE PENSION

★ MONEY FOR YOUR CHILDREN'S EDUCATION

★ DEATH DUTIES

★ MONEY TO FREE YOUR HOME

★ FINANCIAL SECURITY FOR YOUR DEPENDANTS

★ COLLATERAL SECURITY IN BUSINESS AND TRADE

Let us advise you on the plan that will best suit your requirements—the Corporation transacts all classes of Insurance . . . CONSULT

SEEDAT BROS.

4 Hoosen's Building, — 116 Queen Street, — Durban.

Phone: 21773

FOR
RUBBER STAMPS

AND

PRINTING

CONTACT

**STANDARD
PRINTING PRESS**

GENERAL PRINTERS

AND

RUBBER STAMP MAKERS

73 BEATRICE STREET — DURBAN.

PHONE 61005
FOR BOX 2782

TELEGRAPHIC ADDRESS
"QUICKPRINT"

ESTABLISHED 1927

DHIRUBHAI P. NAIK

Travel, Insurance & General Agent

Book with us for your travelling by Air, Sea or Land either to India or to any part of the world.

All types of insurance—Life, Fire, Burglary, Riot, Storm, Accident, Plate Glass, etc.

Consult us free of charge for your Income Tax, Personal Tax, Writting of Your Books, Trade Licences, Revenue Clearance Certificate, Passports and Immigration Matters.

Representative: National Mutual Life Asso. of Australasia, Yorkshire Insurance Co. Ltd.

Telephone: 33-9033. 29a Commissioner Street, JOHANNESBURG.

Phone
Day 24169

Phone
Night 833459

L. RAJKOOMAR (PTY.) LTD.

14, CROSS STREET, DURBAN.

Funeral Directors and Manufacturers of all classes of Coffins and Wreaths

Contractors to the INTERNATIONAL FUNERAL INSURANCE COMPANY, LIMITED.

Reg. Office: 39 CROSS STREET, DURBAN

Country Orders for Coffins and Wreaths accepted by phone and despatched by rail at the shortest notice.

INDIA LETTER

(From Our Own Correspondent)

Bombay, July 20

WITH the inauguration of the Bhakra Canal and the Nangal Dam of India, Mr. Jawaharlal Nehru began a new era in the history of our north-western States, Punjab, Pepsu and Rajasthan. There was jubilation among the farmers for whom a new era of prosperity began.

Among the schemes of economic development undertaken by the Government of India in recent years, Bhakra Nangal is by far the biggest and the most ambitious. In fact, it is the biggest multi-purpose project of its kind being executed anywhere in the world today. The project which was conceived in 1908 by Sir Louis Dane, then Lieutenant-Governor of the Punjab was started in 1946, before the partition of India. But the work commenced in right earnest only in 1948.

The Bhakra Nangal project envisages the building of Bhakra Dam—a 610 feet high straight gravity structure of cement and concrete at a cost of Rs. 140 crores. Its length at the top would be 1700 feet. At the lowest point it will have a width of 675 feet, excluding spillway apron. In order to protect the dam and appurtenant works in the event of flood conditions in the river, provision has been made for a central spillway in the Dam. Two tiers of outlets with 10 outlets in each tier will be provided to enable release of supply from the reservoir for irrigation purposes. It would be possible to instal 10 generating units each with a capacity of 90,000 K.W. at the Bhakra Dam for generating hydro-electric power.

The reservoir created by the Bhakra Dam will have a total storage capacity of 7.4 million acre feet of water. It will create Gjhind Sagar lake which will be about 50 miles long. The width of the lake just upstream of the Dam will be about 3 miles.

To facilitate construction of the Dam, it was necessary that some means of diverting the river from its normal channel at the dam site be found out, so that dry area is available for construction operations. This has been achieved by the construction of two diversion tunnels on both sides of the river. The tunnels are of 50 feet finished diameter and are about half a mile each in length.

They are complete in all respects. Diversion of the river will be accomplished by means of two coffer dams, upstream and downstream of the Dam site.

About 8½ miles below the Bhakra Dam, another dam called Nangal Dam has been built. The Nangal Dam will beid up the river supplies by 53 feet and will serve as a balancing reservoir for taking up the diurnal fluctuations in the Nangal-Hydel Canal with the change in load at Bhakra Dam. The structure of this Dam is complete now with all the gates and gearings installed. The supplies above this Dam have been headed up by 36 feet at present and after the Bhakra Dam has been completed, these will be further headed up by another 17 feet. Thus with the creation of Nangal lake, a roaring river has been made to flow in a mild way. The Nangal Hydel Canal off-takes from the upstream of the Nangal Dam.

The Nangal-Hydel Canal is about 40 miles in length and has been lined with cement concrete or tiles, and is one of the biggest irrigation canals in the world. The shingle and gravel arriving in the river during the floods will be excluded at the shingle excluder upstream of the Nangal head regulator in the river. The silt ejector at mile 2 of the canal will exclude the coarse silt and will permit relatively clearer water to proceed on to the Power Houses at miles 12 and 18 of the canal. The Nangal Hydel canal passes through very difficult terrain having fillings going up to 80 feet and cuttings up to 100 feet. All this difficult work was executed by Indian engineers with little foreign help. They completed their work one year ahead of the schedule.

There are two power houses on the canal, one at mile 12 called Ganguwal power house and the other at mile 18 called Kotla power house. Each power house will generate electricity to the tune of 48,000 K.W. as at present only two units are being installed. The Ganguwal power House is nearing completion and is expected to be brought into commission by August 1954. The Kotla power house is in a fairly advanced stage and is expected

to be brought into operation next year.

The irrigation system of the project consists of the Bhakra main line and Bist-doab canal. The total length of the main canals and branches is 677 miles and that of the distributeries 3958 miles. The number of cross-drainage works in the entire system is 48 and that of road bridges 250. Seventeen railway bridges have also been constructed. The total earthwork involved was 239 million cubic yards. Now this world's largest canal network was inaugurated by Mr. Nehru.

At present only flood water will be diverted to these canals for Kharif crops. No perennial waters will be taken. At present they will irrigate 3,520,000 acres of land. By irrigation the food production of the area will increase by 1,1300,00 tons. Besides increasing food production in three participating States of Punjab, Pepsu and Rajasthan, 40 per cent of the land to be irrigated will be devoted to raising long staple cotton to feed the ever-increasing textile industries in the country. It is estimated that about 800,000 bales of long staple ginned cotton will be produced every year in the area saving the country Rs. 300 millions in foreign exchange. Increased food production will save the country another Rs. 600 millions.

When the whole project is completed 586 million acres of land will come under irrigation. The production of food and cash crops would increase correspondingly. Ultimately 400,000 K.W. of electrical energy will be generated and supplied to 128 towns over and above the villages of the area. Nearly 2.5 million persons are expected to be rehabilitated in the new Mandi townships springing in the area.

Inaugurating and "dedicating to the people" the Bhakra Canals, Mr. Nehru made it clear that supplies to Pakistan from Sutlej river will not be affected as only the extra rain and flood water, which would have gone to sea and wasted, would be stored and diverted to this canal system. India did not wish to harm Pakistan but at the same time India cannot hold her development schemes for ever due to intransigence of Pakistan. He requested Pakistan to accept the World Bank's award.

But Pakistan has raised a big hue and cry about opening of Bhakra canals. Many Pakistani newspapers and Muslim League leaders have demanded a holy war against India. But

political circles in India believe that this is a political stunt of the tottering Muslim League to divert the Pakistani people's attention away from domestic problems. The Muslim League wants to rehabilitate itself by raising a cry of danger from India and is bound to fail once again.

The Government of Pakistan has lodged a "strong protest" with the Government of India and described the opening of the Bhakra canals as a "breach of agreement of March 1952, under which India undertook to safeguard the then existing uses of canal waters in Pakistan during the period of negotiations under the aegis of the World Bank." Further, Pakistan has declared that it has not rejected the Bank's award and that negotiations were still continuing in Washington.

World Bank officials said in Washington that the "opening of the Nangal Dam in India did not create any immediate problem concerning the Indo-Pakistan dispute over the waters of the Indus river system. The opening of the canal system had been anticipated and had been taken into consideration in our discussions on this matter with India and Pakistan."

The majority of shares and capital of the World Bank are held by America. Most of the officers are Americans. Still they have found that India should have exclusive rights over three eastern rivers including Sutlej. India is adversely affected by the award as she will have to pay Rs. 40 to 60 crores for new canal links in Pakistan.

It is important to note that the Bhakra project was conceived and the work on it had started before the partition of India. Further, India had made quite clear to the World Bank before joining the Indus Basin Working Party in March 1952 that work on Bhakra canals must and would go on. So, as the World Bank officials have acknowledged this question was taken into consideration. The standstill agreement concluded in March 1953 before the Working Party started negotiations are no longer applicable. The Working Party itself has been dissolved following Pakistan's rejection of the World Bank's proposals for the division of the waters of the Indus basin. Pakistan's insistence that negotiations are continuing is contrary to the fact. As far as India is concerned the negotiations have ended. India has, nevertheless, expressed her willingness to participate in any new effort

towards a settlement of the canal waters dispute provided Pakistan accepts in principle the proposals of the World Bank.

Meanwhile, for at least this season, India has no intention of withdrawing more water from Sutlej than what can be replaced by Pakistan through Balloki-Sufemanki link. The withdrawal of water from Sutlej through the Bhakra canals is only a fraction of what can be replaced by Pakistan through Balloki link, which feeds the surplus waters of Chenab river into Sutlej through Ravi. This link was inaugurated in April last.

Morally, Pakistan has no claim to the waters of the Sutlej. Even before partition, according to the tripartite agreement of 1920 entered into between the undivided Punjab, Bikaner and Bhawalpur, the Sutlej valley canals now in Pakistan had no right to the waters of the Sutlej. At best, they had only a residuary interest after the requirements of the Bhakra-Nangal project (in Indian territory) had been met.

According to the Water Treaty of May, 1948, Pakistan was to reduce progressively withdrawals from Sutlej. Now Pakistan is playing delaying tactics.

India has become self-sufficient in foodgrains. The last controls on rice have disappeared. The prices of foodgrains are going down and the Government is worrying about stabilising the prices.

R. VITHAL

Bookkeeper, Writing up Sets of Books, Balance Sheets, Income Tax Returns.

Contact No 213 Macosa House, Second Floor, 17 Commissioner Street, Ferreira Street, Johannesburg.

BOOKS FOR SALE

- Satyagraha In S.A.
—By M. K. Gandhi 15/-
- A Gandhi Anthology
—By V. G. Desai 9/-
- Which Way Lies Hope
—By R. B. Gregg 2/-
- Why Prohibition
—By K. M. Rappa 1/-
- Gandhi And Marx
—By K. G. Mashruwala 2/8
- Bapoo's Letters To Ashram Sisters
—By Kula Kattelkar 2/6

Obtainable from:

'INDIAN OPINION,'
P/Bag, Phoenix, Natal.

BOOKS FOR SALE

- UPANISHADS FOR THE LAY READER
—C. Rajagopalachari 6 0
- VEDANTA THE BASIC CULTURE OF INDIA
—C. Rajagopalachari 5 6
- BHAGAVAD GITA—Abridged and explained
by C. Rajagopalachari 4 0
- INTERNATIONAL SHORT STORIES
—The best from 23 countries 11 6

Obtainable from:

INDIAN OPINION,

P. Bag, Phoenix, Natal.

HIND SWARAJ OR INDIAN HOME RULE

By Gandhiji

Gandhiji says regarding it:

"It (the book) teaches the gospel of love in place of that of hate.....It pits soul force against brute force. It has gone through several editions and I commend it to those who would care to read it." Written in 1908 it contains in essence Gandhiji's later teachings on various topics.

New Revised Edition with an introductory essay by Mahadeo Desai

Price: 1s. 6d.

Obtainable from:

'Indian Opinion', P. Bag, Phoenix, Natal.

BOOKS FOR SALE

- | | | | | | |
|---|----|-----|---|----|---|
| INDIAN JUDGES (Biographical and critical sketches with portraits) | 7 | 0 | SOVIET ATTITUDE TOWARDS CHINA
Facts And Facts—Stanley Powell | 5 | 0 |
| EMINENT AMERICANS WHOM INDIA SHOULD KNOW—Jabez T. Sunderland | 7 | 6 | AMONG THE GREAT (Conversation with Romain Rolland, Mahatma Gandhi, Bertrand Russell, Rabindranath Tagore and Sri Aurobindo)—Dilip Kumar Roy | 23 | 0 |
| THE BHAGAVAD GITA—The Lord's Song—(An English Translation)—Annie Besant | 1 | 1 0 | TWO HISTORICAL TRIALS IN RED FORT
—An account of the trial of the Officers of the I.N.A. | 14 | 0 |
| WHAT IS WRONG WITH INDIAN ECONOMIC LIFE?
—Dr. V. K. R. V. Rao | 3 | 0 | WHY CRIPPS FAILED (Documented account from the Indian Nationalist point of view)—M. Subrahmanyan | 2 | 6 |
| OUR INDIA (Children's stories by various writers, illustrated)
—Mino Masuni | 2 | 6 | GANDHI-JINNAH TALKS (Text of Correspondence and other relevant matter) | 2 | 6 |
| COTTAGE INDUSTRIES AND THEIR ROLE IN INDIAN ECONOMY—Prof. Rao | 2 | 6 | THE STORY OF MY EXPERIMENTS WITH TRUTH
—M. K. Gandhi | 16 | 0 |
| GOLDEN NUMBER OF "INDIAN OPINION", 1914 (Souvenir of the Passive Resistance Movement in S.A., 1908-1914) | 1 | 0 | CHRISTIAN MISSIONS IN INDIA
(Their place in India)—M. K. Gandhi | 5 | 0 |
| THE DELIVERANCE (A picture of the palpitating life of the joint family) | 4 | 6 | RAMANAMA—M. K. Gandhi | 2 | 0 |
| GANDHIAN TECHNIQUES IN THE MODERN WORLD—Pyarelal | 2 | 0 | TOWARDS NON-VIOLENT SOCIALISM
—M. K. Gandhi | 5 | 0 |
| INDIAN STATES' PROBLEM (Gandhiji's Writings and Utterances)—M. K. Gandhi | 10 | 0 | REBUILDING OUR VILLAGES—M. K. Gandhi | 8 | 0 |
| FOUNDATIONS OF PEACE (Critical study of the conditions which precipitated two world wars)—K. T. Shah | 16 | 0 | AN ATHEIST WITH GANDHI—Gora G. R. Rao | 2 | 0 |
| INDIA SPEAKING (Various contributions on economic, political, cultural and social problems of modern India) | 16 | 0 | | | |

Obtainable from:

'Indian Opinion,'

P. Bag, Phoenix, Natal.

M. J. PATEL

INTERNATIONAL SPORTS COMPANY
Importers & Exporters & General
Commission Agents

10 Peking Road, Kowloon, HONG KONG.

**Special attention is paid
to indent orders**

Write To Us For Further Particulars.

LIFE INSURANCE

Are you adequately insured?

Have you provided for your dependants?

Prepare for the future

Life Insurance gives peace of mind for the unknown future.

Insure with "THE OLD MUTUAL" your friend for Life—
The S.A. Mutual Life Assurance Society, which has
best Bonus record in the WORLD.

Representative:—

DAYABHAI PATEL

P.O. Box 1760,
JOHANNESBURG.

Phones:— } Business 33-0711
 } Residence 33-5961

Phone 53.

Telegrams 'SOLANKI.'

P.O. Box 208.

Solanki & Co. Ltd.

Merchant & Direct Importers

**Extensive range always carried in
the following:**

Silks, Drapery, Toilets, Per-
fumes, Curios, Fashion Goods
and Jewellery, Wide Range of
Indian, Persian and Chinese
Carpets.

Stockists of well-known branded
Watches.

COPPERBELT PIONEER STORE

**Where Quality and Service
are Paramount.**

Luanshya,

Northern Rhodesia.

Tel. Add: "Charotar" Telephone: 33-9885.

MANCHESTER TRADING

—CO. LTD.—

ESTABLISHED 1923

Wholesale Soft & Fancy Goods Merchants

—&—
Direct Importers.

**47, Commissioner Street,
JOHANNESBURG.**

Cable & Tel. Add.: "HARGVAN".

Phone 29368

P. HARGOVAN & CO.

(PTY.) LTD.

**WHOLESALE MERCHANTS
AND IMPORTERS.**

P. O. BOX 1250.

155/7 Warwick Avenue
DURBAN.

BOOKS FOR SALE

GANDHIANA—D. G. Deshpande—(A Bibliography of Gandhian Literature)	5	0
PILGRIMAGE FOR PEACE—Pyarelal	12	6
TO STUDENTS—M. K. Gandhi	6	0
GANDHIAN ETHICS—Benoy Gopal Ray	2	0
BAPU—Marry F. Barr	4	0
COMMUNAL UNITY—M. K. Gandhi	25	0
FAMOUS PARSIS	7	6
SEVEN MONTHS WITH GANDHI—Krisnadas	12	6
STORY OF THE BIBLE—S. K. George	8	0
A RIGHTEOUS STRUGGLE—Mahadev Desai	2	3
THE POLITICAL PHILOSOPHY OF MAHATMA GANDHI—Gopinath Dhewan	17	9
GANDHIJI AS WE KNOW HIM—Intimate and delightful incidents by various writers	9	0
NON-VIOLENCE IN PEACE AND WAR		
Vol. I.—M. K. Gandhi	15	0
NON-VIOLENCE IN PEACE AND WAR		
Vol. II.—M. K. Gandhi	14	0
THE STORY OF BARDOLI—Mahadev Desai	6	0
FROM YERAVDA MANDIR—M. K. Gandhi	1	0
MAHADEV DESAI'S EARLY LIFE		
—By Narabari D. Parikh	2	6
DEHUMANIZATION IN MODERN SOCIETY		
—Rene Fulop-Miller	1	0

Obtainable from:

"INDIAN OPINION,"

P. Bag. Phoenix, Natal.

Phones: 29121/3 (Switchboard)
24179 (Manager)

Cables & Tel. Add:
"PROSPERITY" (All Branches)

P.O. Box 2197

(Established 1927)

Premier Produce Co. (Pty) Ltd.

General Wholesale Merchants
EXPORTERS AND IMPORTERS

Buyers and large Stockists of all kinds of Indian and European Groceries, Provisions, Soaps, Oils, Grains, Beans, Peas, Kaffircorn, Malt, Maize, Maize Products, Wheat, Wheaten Products, Crockery, Hardware and also Coal of all types.

All enquiries for Export and Import
to the Head-Office.

Head-Office: "PREMIER HOUSE"
364 Pine Street, Durban.

also at

JOHANNESBURG

Phones: 34-3554/5
P.O. Box 200, Fordsburg,
82, Crown Road,
Fordsburg, Johannesburg.

BENONI

Benoni Coal Site
Phone 54-1813,
Rangeview Coal Sites—54-2205
P.O. Box 392, Benoni.

ATTRACTIVE SAREE MATERIALS

Self Striped Georgette Crepes 45"
Green, White, Pink, Sky, Lemon
4/11 yd.

Coloured Georgettes 45"
All Shades 3/11 yd.

Self Check Fancy Voiles with Block
Designs 45" 4/11 yd.

Spotted Georgettes 45" Latest 4/6 yd.

Fancy USA Floral Voiles 38" 4/11 yd.

Embossed Georgettes 45"
Basket Design 6/11 yd.

Two Tone and Rainbow Georgettes 45"
All Shades 4/11 yd.

Georgette Jari Work Sarees
£4-10-0 each

Floral Bembergs 45" Red, Gold,
Green and Blue Designs 4/6 yd.

Georgette Sarees Cotton Embroidery
£3/15/0 each

Bordered Georgette 45"
All Shades 3/11 yd.

Benares and Tinsel Jari Borders
Big Range In Stock

BLOUSES

Chinese Embroidered Satin and
Georgette Blouses and Latest
Skippers 8/11 each.

CHAMPALS!

Plastic Fancy Tops with Heel
Size 3 to 7 18/6 pair
Also Leather 8/6 & 10/6 pair.

Write For Samples:

JAYBEE SILK HOUSE

39 MARKET STREET, JOHANNESBURG.

Proprietors:

C. L. Patel, D. K. Patel
V. B. Patel, H. J. Patel
E. C. Patel

The Star Clothing Factory

Wholesale Merchants

CLOTHING MANUFACTURERS

P.O. Box 237. Phone 514.

Jameson Road, Livingstone,
NORTHERN RHODESIA.

Our S.A. Representative:

H. L. Hompes & Co.,
(Pty.) Ltd.

Durban, P.O. Box 1301.
Johannesburg, P.O. Box 3480.
Capetown, P.O. Box 824.

NEW TYPEWRITERS

POPULAR MAKES

Remington, Smith-Corona, Olivetti,
Hermes, R. C. Allen.

PORTABLE & STANDARD MODELS
AVAILABLE AT:

NATIONAL OFFICE SUPPLIES
(PTY. LTD.)

(Directors: N. V. MEHTA, J. P. GOKOOL, K. V. MEHTA)

LEGAL & COMMERCIAL STATIONERS
OFFICE EQUIPMENT SPECIALISTS

76 Victoria Street, Durban.

PHONES 22622
63535

P. O. BOX 1327
Tel. Add. NOSLIMITED.

For Quality Printing Consult :-

UNIVERSAL PRINTING WORKS

Commercial Printers & Calendar Specialists

9 Bond Street, Durban, Phone 25295.

ઇન્ડિઅન

ઓપિનિઅન

મહાત્મા ગાંધીજીના હસ્તે અને ૧૯૦૩માં સ્થપાયું.

પુસ્તક પર મુ-અંક ૩૦
તા. ૧ ઓગસ્ટ, ૧૯૫૪.
પુટક નક્કલ પેની ૬.
દર શુક્રવારે બહાર પડે છે.

“બીડી સિગરેટથી મને ત્રાસ છુટે છે”

જેમ દારૂથી તેમ બીડી સીગરેટથી મને ત્રાસ છુટે છે. બીડી પીતી એને હું દુર્યોજી મણ્ડું છું. એનાથી માણસ નું અંતઃકરણ મુર્છીત થાય છે, અને એ વારંવાર દારૂને ટપી નાખે છે, કારણ એની અસર કળાતી નથી. એ ખર્ચાળ દુર્યોજી છે. એનાથી ત્રાસ મંધાઇ ઉઠે છે, દાંત ઉપર ડાબા પડે છે અને કોક વાર કેન્સર પણ થાય છે. એ મંદુું વ્યસન છે.

એ ટેવ જાંઘલી, મંદીને દ્વાનીકારક છે એમ મેં સદાય માન્યું છે... જે આગમણીના ડબામાં...બીડી કુંકાતી હોય ત્યાં એસવું મને બારે યજ પડે છે અને તેના કુમાડાથી હું યુગબાધ બળી છું.

બીડી સીગરેટ અને ચા કોશી છવન ને આવશ્યક નથી...કેટલાક...દિવસ ના કોશીના ૧૦ ખાલા પીએ છે. કામ કરવા સાડ પોતાને જાગતા રાખવા માટે એ જરૂરનું છે? જો એમ હોય તો તે ચા કોશી ન પીએ પણ ઉધી નાખ. આ વસ્તુઓના આપણે ઘાસ ન ખાવું જોઈએ. દેશી કે પરદેશી બીડી, સિગાર, સિગરેટથી દુર રહેવું હશે. બીડી સિગરેટ થેનના ઓસડ જેવી છે, અને તમે સિગાર પીએ છો તેમાં અશીયુની વાસના હોય છે. તમારા મોઢાને કુમાડીયું ખનાવીને જેમ જગાડો છો?

...રોસ્ટોયની વાતોમાં એક દારૂ ડીપો સિગાર નથી પીતો ત્યાં જગી કરવા પારેલું ખુન કરતાં અચકાય છે. પણ સિગાર કુંકયા પછી તે રિમત કરતો ઉઠે છે; ‘હું કેવો કામર છું’ એમ કહે છે, અને કટાર લઇને કાળું કામ કરે છે. રોસ્ટોયની આ અનુભવશાળી છે. તેનો અંત અનુભવ કયો વિના એણે કાંઈ લખ્યું નથી. અને એ દારૂ કરતાં બીડી સિગરેટનો બહુ વિરોધ કરે છે. પણ દારૂને તમામુમાં દારૂ ઉતરવું અનિષ્ટ છે એવી બોડી ગણ્યતરી તમે ન કરતાં. એમ નથી. જો બીડી-સિગરેટ દિરખાક હોય તો દારૂ દિરખાકશિપુ છે.

ગાંધીજી.

(વાલજી ગોવિંદજી દેસાઈ દ્વારા ‘ત્રિમધ્ય’માંથી).

સંકુચિત રાષ્ટ્રવાદ

મુરહુમ ડો. એ. અબ્દુરહમાન દક્ષિણ આફ્રીકામાં બીન-ગોરાઓના એક બાહોશ નેતા હતા. ૧૯૩૧ની સાલમાં ફ્રેન્ચાર્બઝ એમેન્ડમેન્ટ બીજા પાર્લામેન્ટમાં રજુ કરવામાં આવ્યું તે વખતે કેપટાઉનમાં રંગવણીઓની સભામાં તેમણે કહેલાં ભાષણના નીચેના સારને માટે અમે ડરબનની કલડ’ પીપ્લસ કાઉન્સીલ ઓફ એક્શનના સેક્રેટરીનાં આભારી છીએ. તે અંદિ છાપીએ છીએ કારણ સમય વહેવા છતાં એ શબ્દોનું મહત્વ ઘટેલું નથી બલકે આજના સંજોગોને તે બરોબર બંધ બેસતું છે :

“યુનીયન સ્થપાયા બાદ કેપ પ્રાંતમાં ગોરા અને રંગવણી ઢોઢો વચ્ચે હવે સારી લાગણી નથી અને બીન-ગોરાઓની પરિપદોમાં એ લાગણી ફરી લાવવાના પ્રયત્નો કરવા છતાં સરકારે સઘળા બીન-ગોરાઓને બાતલ રાખનાર રાષ્ટ્ર સ્થવાનો નિર્ધાર કરેલો છે, એ સ્પષ્ટ છે. હુબોગ્યે નેશનલીસ્ટો “રાષ્ટ્ર”નો અર્થ સમજતા નથી. તેઓ માને છે કે સઘળાઓને બાતલ રાખનારા એક નહાના જાતીય વર્ગને રાષ્ટ્ર કહી શકાય. તેઓ એટલા મૂર્ખ છે કે એટલું સમજી શકતા નથી કે, રાષ્ટ્રમાં એક કરતાં વધારે જાતીઓનો સમાવેશ થઈ શકે, તેઓની ભાષા એક કરતાં વધારે હોઈ શકે, અને એક કરતાં વધારે ધર્મો પાળવામાં આવતાં હોઈ શકે. રાષ્ટ્ર સ્થવાને મહત્વની વસ્તુઓ બ્રાનુભાવ, અરસપરસતા અને પોતાના ઢેશ પ્રત્યેની વફાદારી છે. એવી ભાવના અને લાગણી હોય તો સૌ પોતાની શક્તિ સુજળ ઉચ્ચ જીવને પહોંચવાની આશા રાખી શકે. પરંતુ આજે એ વસ્તુ નેશનલીસ્ટો ઇચ્છતા નથી. તેઓ સંકુચિત, કડવાશ ભરેલી અને જેરીલી લાગણી ધરાવતા વર્ગનું રાષ્ટ્ર સ્થવાનો પ્રયત્ન કરે છે. દક્ષિણ આફ્રીકાના અંગ્રેજો સુદાને પાછળ ધકેલી દેવામાં આવી રહ્યા છે, પછી આફ્રીકનો અને રંગવણી ઓનું તો પુછવું જ શું? તેઓને શુભાભીમાં રાખવામાં આવશે. પરંતુ બાતલ રાખવામાં આવેલા સઘળાઓ જો સંગઠીત થઈ ઉભા રહે તો નેશનલીસ્ટો નિષ્ફળ જશે. નેશનલીસ્ટો બીન-ગોરાઓ પ્રત્યેની પોતાની વલણ બદલશે નહિ તો એક દિવસ એવો આવશે જ્યારે રચટસ એસોગબલીઝ એકટ છતાં પણ કારણનાઓના કામદારોમાં રહેલી સુપ્ત શક્તિને એકત્રીત કરનાર કોઈક પેદા થશે અને સઘળા સ્વતંત્ર ઢોઢો જે દરજ્જાને ભેગવવાને હકકાર છે તે દરજ્જાથી અમને વિરકત રાખનારી સાંકળોને તોડી નાખશે. સંભવીત છે કે અંગ્રેજો પણ જાગૃત થશે અને અસુરે ઘાય તે પહેલાં પોતાના હકોનું રક્ષણ કરશે. સઘળી આશાઓ ભગ્ન થયા પહેલાં જરૂર તેઓ તેમ કરશે જ.

સુખ’ નેશનલીસ્ટોએ સમજવું જોઈએ કે દક્ષિણ આફ્રીકામાં પણ કુદરતી નીચગને બદલી શકાય તેમ નથી. બીન-ગોરાઓપર લાંબી સુદત સુધી તેઓથી અન્યાયથી રાજ્ય ચલાવી નહિ શકાય. અગારા ઢોઢોનો પ્રેમ અને વફાદારી તેઓ જીતશે નહિ, આ ઢેશનું તંત્ર તેમ જ સઘળા ઢોઢોના હિતમાં ચલાવવા માગે છે એવું બતાવી આપશે નહિ, તો આજ્ઞતથી તેઓ ઘેરાઈ જશે.”

“ઇન્ડિયન ઓપિનિયન”

શુક્રવાર તા. ૬ ઓગસ્ટ, ૧૯૫૪.

વળી પાછા ડો. મહાન

ટલાક લોકો આરંભ આંખા પહેલાંજ તેના ડરથી મરી જાય છે. આપણા વડા પ્રધાન ડો. મહાન આજે એ શોચનીય સ્થિતિમાં આવી પડેલા જણાય છે. હાંદીના વડા પ્રધાન શ્રી નેહરુ સામે તેઓએ કરી અખાળા કાટયા છે. હાંદી અને આફ્રિકન તેમને રવખામાં પણ સતાવતા જણાય છે. એ તેમનું તેમજ તેમની સરકારનું ડંખી રહેલું અંતઃકરણ સુચવે છે. તમ છતાં શ્રી નેહરુને વિષે કંઈક સારું કહેવાનું ડો. મહાનને મળેલું છે એ નોંધ લેત અમને આનંદ થાય છે. તેમણે કહ્યું કે શ્રી નેહરુ ૨૫૮ વકતા છે. એ અગત્યની વસ્તુ છે. તેપરથી તિલ્લ થાય છે કે હાંદીના વડા પ્રધાન માં કશું કપટ નથી, કે જે આજના શાહીશાહી માનસતાં રાજદ્વારીઓને વિષે કહી શકાય તેમ નથી. શ્રી નેહરુ ને કશું છુપાવવાનું નથી. તેઓ સાફ સાફ વાત કરી દે છે અને કહે છે તે સુજળ તેમનું આચરણ હોય છે. પરદેશમાં હાંદીને સંસ્થાનો મેળવવાનો સાર્ય છે એવા તેનાપર મુકવામાં આવેલા આરોપનો શ્રી નેહરુએ અનેક વાર ઇન્કાર કરેલો છે. એક વસ્તુ તેમને વિષે છે, તે એ છે, ખીસીત લોકોને અત્તાનાહ તેમને કાને પડે તેને તેઓ દુલ્લેહ આપતા નથી, પછી બને તે ગમે તે રથળેથી આવેલા હોય. તેને રાહત આપવાને તેઓ પોતાનું બનવું કરે છે. સત્તાથી મદાંધ બનેલા અને પોતાની લોખંડી એડીઓ નીચે ઠયગણેલા રાખવામાં આવેલા લોકોની લાગણીઓ અને અભિલાષાઓની પરવા કથી વિના તેઓપર સર્વ સત્તાધીશપણું અલાવવાની ઇચ્છા રાખનાર અને તેમ કરવાનો પોતાનો ઇચ્છરદત્ત હક છે એમ સમજનાર જુલમગારને જે એ વસ્તુ કહતી હોય તે તેમા શ્રી નેહરુ, જેઓ સવળું માનવી-મનાની દ્રષ્ટ્ય જ નેનાર છે, તેઓ દોષિત નથી. અમે શ્રી નેહરુને યોગી રીતે ખવાવ કરવા ઇચ્છતા નથી સધળા માનવી માની જેમ તેમનામાં પણ માનવી તરીકેની નયજાણ્યો છે. પોતે સંત હેવાનો તેમણે કદી દાવો પશુ કરેલો નથી. તેમ કેટલાક લોકો દક્ષિણ આફ્રીકામાં કરી રહ્યા છે તેમ તેના એવો પણ દાવો નથી કરતા કે પોતાના કરતાં જુદી આમરીવાળા લોકો કાયમના

તેઓનાં ગુલામ તરીકે રહેવાને સરખાવેલા છે. એટલે સત્ય, ન્યાય અને નીતી શ્રી નેહરુના પક્ષમાં છે અને તેટલાજ કારણથી તેમને કશું છુપાવવાનું નથી અને તેઓ દુનિયાની સમક્ષ છાતી કાઢીને ઉભા રહી શકે છે અને પોતાના વિચારો અને માન્યતાઓ નિર્ભયપણે વ્યક્ત કરી શકે છે.

મોટામાં મોટું પાપ

ડો. મહાનના કહેવા મુજબ શ્રી નેહરુનું મોટામાં મોટું પાપ એ છે કે તેઓ સંસ્થાનવાદના વિરોધી છે. દક્ષિણ આફ્રીકાને તે લાગુ પાડવામાં આવે તે તેનો અર્થ, ડો. મહાન કહે છે કે, એ યામ કે, ગોરાને આફ્રીકા છોડી જવું પડે. તેનો એવો અર્થ તોજ થાય જે ગોરા ગણના જેવું જકડીપણું પતાવે અને પોતાની ગેર-વાજબી, અન્યાયી અને અનીતી બરેલી ઇચ્છાઓને વિષે અણુનમ રહેવાનો દુરાગ્રહ કરે. ગોરાં આ દેશ છોડી જાય એમ કોઇ પણ ઇચ્છવું નથી એવું ન બને એવું સૌ કોઇ પ્રાર્થે છે. તેમ છતાં જે ગોરાને આ દેશ છોડી જવો પડે તે હોય કેવળ ગોરાનો જ ગણાયો.

કોઇ પણ દેશની આંતરિક યાજનો કઇ કહી શકાય એ વિચારવાનું રહે છે. સાધારણ જુદીની દ્રષ્ટિએ જેતાં ન્યારે એક ધણીજ ન્દાની લઘુમતી પ્રજા વિશાળ બહુમતી પર, એ બહુમતીની સંમતી વિના કુરાંજ્ય અલાવવાની પોતાના હાથમાં સત્તા લઇ લે ત્યારે એ કુરાંજ્ય અલાવતી લઘુમતી પ્રજાથી ન્યાયના કોઇ પણ સિદ્ધાંતથી એવો દાવો નહિ કરી શકાય કે એ તેની “આંતરિક યાજનો છે.”

ડો. મહાન શ્રી નેહરુપર એવો આરોપ મુકે છે કે કાયદાને ભંગ કરવાનું તેઓ ઉચ્ચત્ત આપે છે. ડો. મહાન કહે છે કે “તેનો પુરાવો એ છે કે, દક્ષિણ આફ્રીકાના હાંદીઓને તેમણે અપીલ કરી છે કે સામુદાયિક હાલ કરવામાં આફ્રિકાને તેઓએ સાથ આપવો.” કહેવાય છે કે હિટલરની પારભિષત એ હતી કે એક જુદાણું કરી દરીને કલા કરવું એટલે છેવટે તે સત્ય તરીકે ખાળી જાય. એજ ખાસી યત આજે સામ્યવાદીઓની હોવાનું કહેવાય છે. રજેને ડો. મહાનને તેનો એવ તેમ નથી લાગ્યો! શ્રી નેહરુએ

એની કશી અપીલ હાંદીઓને કરીજ નથી. તેઓએ એમ કહેલું છે ખડું કે આફ્રિકાને ગેરલાભ થાય એવા હોના હાંદીઓએ મામણી નહિ કરતી. આ દેશમાં હાલ કેની રીને અલાવવી તેને વિષે પણ શ્રી નેહરુએ હાંદીઓને કદી દોરવણી આપેલી નથી. નીતી અને ન્યાયને માટે અર્ધિસક રીતે અલા વાતી કોઇ પણ હાલને બેશક તેમણે આચિન્નિદ આપેલા છે. પરંતુ તેમ કરવામાં શ્રી નેહરુ એકલાજ નથી. ઇલાવરયા અને ઇમનેરીની જે ડો. મહાનની યાદગરત શકતીપર જુરી અસર નહિ થઇ હોય તે તેમને યાદ હોવું જોઇએ—જેવું અમને ૨૫૮પણે યાદ છે—, ૧૯૪૭ની સાલમાં ન્યારે હાંદી કોમ એ વખતની યુનીયન સરકારની સામે તેના અન્યાયી અને અનીતીબરેલા કાયદા સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહની હાલ અલાવી રહી હતી ત્યારે, એ વખત નાં હાંદીના વાઇસરોય લોર્ડ હાલિંગે સરકારની વલજુને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને હાલને ખુલ્લી રીતે આચિન્નિદ આપ્યા હતા, અને તેને મદદ આપવા હાંદીમાં ફરોડા પણ ઉધરાવામાં હતાં. એ વખતની યુનીયન સરકારના લાભમાં એટલું કહેવું જોઇએ કે, આજની સરકાર કરી રહી છે તેમ, તેનો વિરોધ કરનારા લોકોને ફંધી નાખવાને યદારથી મળતી મદદના સધળાં દાર બંધ કરી દેવા જેટલી તે નિષ્કર નકોતી બની.

પોરયુગીઝ સંસ્થાનો

બીટન અને ઇજીપ્ટ વચ્ચે બંધાયેલી મૈત્રીથી અને પોરયુગીઝ અને હાંદી સરકારો વચ્ચે પડેલા અંટરાથી ડો. મહાન રાચી રહ્યા છે. “આપણા પોરયુગીઝ પડોશીઓ જેઓની સાથે આપણે એટલા સુખ અને શાંતીથી રહેતા આવેલા છીએ,” તેની તેઓ વાત કરે છે. એ સધળું તો અમે જણીએ છીએ. પોરયુગીઝ પ્રદેશમાં યુનીયને આઝાદીથી કેટલો પગપેસારો કરેલો છે એ અમે સારી રીતે જણીએ છીએ. તેની અર્ચા અહિ કરવી અરયાને ગણાયો. અમે એટલુંજ કહીશું કે આ બાખતમાં પણ ડો. મહાન હાંદ અને હાંદીના વડા પ્રધાનને વિષે ખોટું બરમાવી રહ્યા છે. હાંદે કશા આક્રમણને માટે દોષિત છેજ નહિ. હાંદ અને પોરયુગીઝ સરકારો વચ્ચે તે આ કમનસીમ બનાવ અતિ શોચનીય છે. અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થાએ છીએ કે આ એક પસાર થવું તાજણ છે જે ડુંકે યુલ્તમાં વીચેરાઇ જશે અને ગેર-સમજુતીઓ દુર થઇ જાને સરકારો વચ્ચે અમાઉ દની તેવી મૈત્રી પુનઃ સ્થાપિત થઇ જશે. હાંદમાંના પરદેશી સંસ્થાનો વિષેની સ્થિતિ હમઅમ યુનીયનમાંના બીટીસ પ્રોટેક્ટરોના

જેનીજ મણી ચકાવ. દેર માન એટલોજ છે કે, યુનીયન સરકાર એ પ્રોટેક્ટરોને યુનીયનની સાથે જોડી દેવાને પોકાર કરી રહી છે પરંતુ એ પ્રોટેક્ટરોની ખરી પ્રબળી તેમ કરવાને તે સંમતી મેળવી શકી નથી.

યુનીયનનાં ગોરા રાજકીઓની સાથે મળાને કામ કરી રહેલી કેવળ ન્દાની ગોરી લઘુમતીજ એ પ્રોટેક્ટરોને યુનીયનની સાથે જોડી દેવ ની મામણી કરી રહી છે, ન્યારે આફ્રીકાની વિશાળ બહુમતી, જેની એ બાખતમાં સંમતી પણ લેવાઇ નથી, તે તેનો સખત વિરોધ કરી રહી છે. પ્રબળત લેવાની યુનીયન સરકારે હમિત નથી કરી કારણ તે સારી રીતે જણે છે કે એ તેની વિરુદ્ધ જશે.

હાંદમાંના ન્દાના પોરયુગીઝ સંસ્થા નો વિષેની સ્થિતિ એ છે કે તે કેવળ નાખનાંજ છે. આટલાં વર્ષોમાં તેણે કશી પ્રમતી કરેલી નથી. હાંદમાં ન્યારે દારખંધી છે ત્યારે ચારીથી તેનો તેમજ અન્ય વસ્તુઓનો વેપાર કરવાને તેનો ઉપયોગ થનો કોવા ઉપરાંત

“ઇન્ડિયન ઓપિનિયન”ને મદદ ડ્રાંસવાલના જે પ્રબળપતિ બાઇ એ એવો પોતાના નામ બહેર કરવા ઇચ્છતા નથી તેઓએ પ્રત્યે પા. ૨૫ ની રકમ “ઇન્ડિયન ઓપિનિયન”ના નિભાવ અર્થે મોકલેલી છે જે અમે સાખાર રિવકારીએ છીએ.

તેની ખીજ શખત નથી. તંદુ-પરાંત એ સંસ્થાનો, જે હાંદથી જુલાં તરીકે જાણખી પણ શકતાં નથી, તેના નિવાસીઓની વિશાળ બહુમતી હાંદીની સાથે જોડાઇ જવાને તલસી રહી છે. તેનાથી પોરયુગીઝ સરકારને બહુ ગુમાવવાનું નથી ન્યારે ચાળીસ કરોડ ની પ્રબળી જુબેજાનો અમુલ્ય લાભ તેને મળે છે. અમે એટલીજ આશા રાખીએ છીએ કે પોરયુગીઝ સરકાર ડો. મહાનના જોળવાખથી જોળવાઇ નહિ જાય. ડો. મહાનને માટે અમે હમેશાં માન ધરાવતા આવેલા છીએ. “નાહાન દેસત કરતાં દાનો દુરમત બલો.” ડો. મહાન દાના દુરમત છે કારણ ખીન-ગોરાઓ સાથે ના વ્યવહારમાં તેઓ હમેશાં નિખાલસ પજુ અને ખુલ્લી રીતે વર્તાતા આવેલા છે. અમને તેમની હયા આવે છે કે તેમના જીવનનાં સંધ્યાકાળે તેઓ ઇચ્છર પરની બહા ગુમાવો બેરેલા છે અને શયતાનીની ઉપાસના કરી રહ્યા છે. “ગોરાવાદ” રૂપી શયતાન, જેના વિધાતક પંજમાં તેઓ સપગાઇ ગયેલા છે, તેનો ખીન કરો અર્થ થતો નથી.

બ્રીટન અને ઈંગ્લેન્ડ વચ્ચેના કરાર અને હોંદ ઉપર યુનીયનના વડા પ્રધાન

ગાંધીજીની સાથેના મુલાકાત આપતાં યુનીયનના વડા પ્રધાન ડો. મલાને કહ્યું કે બ્રીટન અને ઈંગ્લેન્ડ વચ્ચેના કરારથી ઈંગ્લેન્ડ સાથેની નવી ગૈરરીશ્વપારી કે જે રશીયા અને હોંદની શેઠ; જે હને ખુલ્લી પાડી ગઇ છે, તેની સામે આરંભ રાખ્યાનું રક્ષણ કરવામાં મદદરૂપ થઇ પડશે.

મધ્યપૂર્વની પરિસ્થિતિની સાથે તે હોંદને કેમ જોડી દે છે એ સવાલના જવાબમાં ડો. મલાને કહ્યું કે, શ્રી. નેદરૂ આજે જેમ બીન-ગોરી આલમ ના નેતા બની ખેડેલા છે, તેમ આરંભ રાખ્યાના પછી તે નેતા બની ખેડેલા છે, જે વસ્તુ ચોખ્ખી દેખાઇ આવે છે.

આજે આફ્રીકાનું નામ લેતાં શ્રી. નેદરૂનું રમરણ થયા વિના રહેતું નથી. ડો. મલાને કહ્યું કે શ્રી. નેદરૂ આફ્રીકાને જ સામાન્ય રીતે જોખમરૂપ છે એટલુંજ નહિ પરંતુ ખાસ કરી આપણને જોખમરૂપ છે. આપણે અને ડુનીયાને જે એ બાંસતું નહિ હોય તે તેમાં શ્રી નેદરૂને દેખ નાંખ કાઢી શકાય.

ડો. મલાને કહ્યું કે, એટલું સર્ક છે કે હોંદના વડા પ્રધાન સાફ સાફ વાત કરી દેનારા છે.

ક્યાં જવા માગે છે એ પોને જાણે છે અને પોતાનો હેતુ સિદ્ધ કરવાને કષ્ટ રીતે અજમાવવા માગે છે એ પણ તે જાણે છે. કશો શક તે રહેવા દેના નથી.

વધારે સ્પષ્ટ પુલાસો કરવાનું કહેવા માં આવતા ડો. મલાને કહ્યું કે, શ્રી નેદરૂના વચના, જેને તેમના કબો વડે અનુમોદન મળે છે, તેનો અર્થ એકજ કરી શકાય.

તેમની સ્પષ્ટ નીતી કહેવાતા સંરચનાવાદની વિરૂદ્ધ છે. આફ્રીકાના સંબંધમાં તેનો અર્થ એ થાય છે કે, ચાર યુરોપિયન રાજ્યો જે આફ્રીકામાં સંરચાને ધરાવે છે—એટલે મતલબમાં ગોરા માથુસ—તેણે આફ્રીકા છોડી ચાલ્યા જવું. એ વિશા એ વ્યવહાર પત્રમાં લેવાને પછી તે ખુલ્લી રીતે ઉજોજન આપે છે.

તેઓની આતરિક યાત્રામાં માથુ મારવાનું વાજબીપણું સિદ્ધ કરવાને અને તેને માટે મામ તંબયાર કરવાને અન્ય દેશોમાં સ્થાપિત થયેલી હોંદી કેમિને તે પહાનસર ઉપયોગ કરી રહ્યા છે.

કામદાઓનો ભંગ કરવાનું પણ ઉજોજન આપતાં તે સંકેતિયામ નથી. બેના પુરાવા તરીકે, દક્ષિણ આફ્રીકાના હોંદીઓને તેમણે સાચુદાંવક લગત ચલાવવામાં આફ્રીકાને સાથે જોડાઇ જવાની હાકલ કરી છે અને તેને માટે

હોંદમાં ક'ડો એકકાં કરેલા છે.

આ સમયે આપણા રમરણમાં હવે તાણું જ છે, અને એક અલગીયાં ઉપરજ બીન-ગોરી સંરચાઓની બંધ પારણે મજેલી સમાના સંબંધમાં આપણે જોઇ ગયા કે એ વસ્તુનો હવે અંત આવ્યો નથી.

આપણા પોરચુગીઝ પોરોશીઓ, કે જેમની સાથે અમે એટલાં સુખ અને શાંતીથી રહેતા આવેલા છીએ, તેમની સામે શ્રી નેદરૂ હોંદની સરહદપર આવેલા તેઓના કાવેસર સંરચાઓમાં ખુલ્લી રીતે આક્રમણ કરી રહ્યા છે.

ડો. મલાને કહ્યું કે હું આશા રાખું છું કે પોરચુગીઝ સંરચાઓ સામેના હોંદના આ આક્રમણથી દક્ષિણ આફ્રીકા અને પોરચુગીઝ વચ્ચે તેઓના સમાન કાબો અને સમાન જોખમોમાં ગૈરરી બંધારો.

ડો. મલાને પુછવામાં આવ્યું કે, આફ્રીકામાં શ્રી નેદરૂને હેતુઓ અને પ્રવૃત્તિઓ ઉપરાંત હોંદના વડા પ્રધાન તરફથી જોખમના કંઈ વધારે ચિન્હો છે?

તેના જવાબમાં ડો. મલાને કહ્યું કે, અમારે અને ડુનીયાએ ભવિષ્યમાં શાની આશા રાખવાની છે એ શ્રી નેદરૂએ જવાબી આવેલું છે. એ ઉપરાંત બીજું કશું નથી. શ્રી નેદરૂ એ કહ્યું છે કે, ચાર દેશો છે કે જે ડુનીયાનું ભવિષ્ય નક્કી કરી શકે. એ છે હોંદ, ચીન, રશીયા અને યુનાઇટેડ સ્ટેટ્સ એફ એમેરીકા.

મતલબમાં બ્રીટન સુધાં આખા મધ્ય અને પશ્ચિમ યુરોપની તેમને કરી મથુત્રી નવા, જ્યારે હકીકતમાં, માનવજાતીને અને આખી ડુનીયાના બહાને માટે પશ્ચિમનો સુધારે આપનાર ગોરી પ્રજાઓનું એ જન્મસ્થાન છે.

આનો અથ આપણે માટે શું થાય એ આપણે ત્યારેજ સમજી શકીએ જે આપણે એ વાદ રાખી શકીએ કે ઓરટ્ટેલીયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રીકાની સરહદો એજ મહાસાગર પર આવેલી છે કે જેવાપર હોંદ અને ચીનની આવેલી છે.

આપણું મોટામાં મોટું જોખમ આખરે કદાચ એજ દિશાએ રહેશે અને તેથી આપણી સંરક્ષણની નીતી માં એ વસ્તુ ધ્યાનમાં લેવી જોઇએ. આપણા પૂર્વના કીનારા અને તેની સાથે લાગેલા સમુદ્રો વિષે આપણે એવરશ રહેવું નાંખે જોઇએ.

ઉત્તર પેરીશીક મહાસાગરના સામ્યવાદી વિરૂદ્ધના દેશોને અરસપરસ સંરક્ષણના કરાર કરવાની જરૂર જણાયે છે. અને આપણે પણ પશ્ચિમ હોંદી મહાસાગરમાં અને

આજી ખાજી આવેલા એકજ વિચાર ના દેશો અને તેઓની જવાબદાર માનવજાતીની સાથે એવા કરાર કરવાની જરૂરનો વિચાર કરવો પડશે.

ડો. મલાને પુછવામાં આવ્યું કે, નવું વિચલુદ જાગે તે ખાસ કરી મધ્ય પૂર્વના સંરક્ષણના સંબંધમાં દક્ષિણ આફ્રીકાની સ્થિતિ શું થાય? તેના જવાબમાં ડો. મલાને જણાવ્યું કે, આ સંબંધમાં દક્ષિણ આફ્રીકાની સારી રીતે જાણીતી નીતી, આપણા પોતાનાજ લાભને ખાતર અદર રહેવી જોઇએ.

પરંતુ, મારા મત મુજબ, જે દેશોવેલા દક્ષિણ આફ્રીકાના ખાસ

શ્રી. ભારત યુવક મંડળ (જોહાનીસબર્ગ)

શ્રી. ભારત યુવક મંડળ (જોહાનીસબર્ગ)ના સેક્રેટરીઓ લખી જણાવે છે :

અકસ્માત અગર તે બંધકર બિમારીથી માનવીના જન ખચાવવા તેમને બીજા માનવીનું લોહી આપવા માં આવે છે. એવા અકસ્માત વખતે બીજાનું લોહી મેળવવામાં યુરોપી અને વિશ્વ નહીં તે માટે આજળ થીજ લોહી "બ્લડ બેન્ક"માં જમા રાખવામાં આવે છે. અહીં સાઉથ આફ્રીકન બ્લડ ટ્રાંસ્ફ્યુઝન સર્વિસ તરફથી લોહી એકઠું કરવામાં આવે છે. આ શાખામાં લોહી આપીને માથુસ બીજાના જન ખચાવવાનું પુષ્પ મેળવે છે.

અહીંની હોંદી જનતા પણ આ પવિત્ર કાર્યમાં સારી રસ લે છે. અહીંના શ્રી ભારત યુવક મંડળના સભ્યો તથા અન્ય સ્વયંસેવકો આ કાર્યમાં સાઉથ આફ્રીકન બ્લડ ટ્રાંસ્ફ્યુઝન સર્વિસને સારી મદદ આપી રહ્યા છે. એમના તરફથી તા. ૧૫-૭-૫૪નાં દિન માંથી હોલમાં એક રૂબરુ દાન નજ રાખવામાં આવેલો હતો તે દરસે ૪૧ માનવીઓએ પોતાનું લોહી આપ્યું હતું.

ત્યારબાદ બીજી વખત તા. ૩-૭-૫૪નાં દિને પાટીદાર હોલમાં શ્રી. મોરારભાઇ પરાગજીના પ્રયુષ્પણા હેતુ બીજા રૂબરુ દાન યજ રાખવામાં આવેલો હતો. તે વખતે સાઉથ આફ્રીકન બ્લડ ટ્રાંસ્ફ્યુઝન સર્વિસના પ્રતિનિધિ શ્રી. મીઝરે પ્રસંગોચિત ટુંક પ્રવચન કહ્યું હતું તેમાં તેમણે હોંદી ઝાએ લોહી આપવા ગાંડ્યું છે તે માટે સંતોષ વ્યકત કર્યો હતો. એ લોહીની કેટલી જરૂરીયાત છે તે દાખલા સાથે સમજાવ્યું હતું. તાજેતર માંજ આટલે વર્ષની એક હોંદી પ્રાસિકાને હોસ્પિટલમાં દાખલ કરવા માં આવી છે. તેને દરરોજ એક પાઇટ લોહી આપવું પડે છે. આવા ઘણા કેસો હોસ્પિટલમાં આવે છે,

સંજોગો એતાં, તેમાં ઉમેરે કરવાગ આવે એજ ખર્ચ અને વાજબી મથુખ.

આપણે જે બીજાઓ મદદ કરવાની આપણી ખુશી દર્શાવીએ, અને દર્શાવીએ છીએ, તે બીજાના જે સંરક્ષણ જોગવી રહ્યા છે તેટલાજ સંરક્ષણનો આપણે માટે પણ દાવો કરવાનો આપણને દક છે.

અને જે ઉત્તર એટલાનીક સંધી આપણા જેવા જોઆ, સામ્યવાદના જોખમની સામે મધ્ય પૂર્વના સંરક્ષણ ના એક ભાગ છે, તેઓને લક્કરી સંરક્ષણ આપવી હોય તે એટલુંજ સંરક્ષણ દક્ષિણ આફ્રીકાને પણ આપવા માં આવવું જોઇએ.

જેમાં આ તમે આપી રહેલા લોહીને ઉપયોગ કરી તેમને હિતવન આપી શકીએ છીએ.

આ લોહીની કિમત તે જોખણે એનો લાભ મળે છે તેજ કરી શકે. આમ લોહીની આટલી અગત્યતા જે એ ધ્યાનમાં લઈ આવા રૂબરુ દાન યજ રાખવા પદલ હોંદી સ્વયંસેવકોને એમણે આભાર માન્યો હતો અને દર બળમે મહિને આવા રૂબરુ દાન યજ રાખી આ પુષ્પશાળી પ્રવૃત્તિમાં હોંદી જનતા તરફથી હંમેશાં એ વે સાથ મળતો રહેશે એવી આશા વ્યકત કરી હતી.

શ્રી. વિનયચંદ બી. પટેલે શ્રી. મીઝરનાં બાણ્યોનો સાર યુજનાતીમાં સભજનોને સમજાવ્યો હતો અને આવતા સપ્ટેમ્બરમાં ત્રીજે રૂબરુ દાન યજ ગળી હોલમાં રાખવામાં આવશે ત્યારે આથી પણ વધુ સંખ્યામાં સ્વયંસેવકો રૂબરુ દાન આપશે એવી આશા દર્શાવી હતી.

૫૨બાદ સાઉથ આફ્રીકન બ્લડ ટ્રાંસ્ફ્યુઝન સર્વિસના સ્વયંસેવકોએ લોહી લેવાનું શરૂ કર્યું હતું જેમાં ૭૪ બાઇ બહેનાથ લોહીનું દાન આપ્યું હતું.

આમ આપણી હોંદી જનતા પણ આવા પરાપકારી અને પુણ્યાર્થી કાર્ય માં આટલો રસ લે છે એ જાણી બધાને આનંદ થશે અને આશા રાખવામાં આવે છે કે દક્ષિણ આફ્રીકાનાં બીજાં શહેરોમાં પણ આવા રૂબરુ દાન યજે શરૂ થશે.

ઉસ્તદ માર જગ્ગર ખાત્રી છે

હેડલખર્મ સુરલીમ જમાતને એક ઉસ્તાદની જરૂર છે. ઉરદુ અરબીક પદાવી શકે અને હમામત કરે એવા ચનદી મોલવી સાર્હે અરહ મુરલીમ જમાત, પી. એ. યોક્સ ૬૦ હેડલખર્મ, ડ્રાંસવાલ, એ સરનામે કરવી. મારીક પમાર પાઉં ૨૫ ઉપરાંત રહેવાને ધર તેમજ પાણી, ખત્તી મહત આપવામાં આવશે.

યુનીયન ખાતેના હોદ્દાના દોષ કમી-
શનરના ઝોરીસના ઝિરોસ્ટન્ટ
સેક્રેટરી શ્રી મલહોત્રા ગયા સોગવારે
સ્વીમર કંપાણીમાં પોતાના સધળા
સ્ટોફ સાથે સ્વદેશ જવા રવાના થઈ
ગયા. તેમને છેલ્લી વિદાય આપવા
વચ્ચા લોકો સ્વીમરપર ગયા હતા.

શ્રી મલહોત્રા શુક્રવાર છુલ્લો તા.
રજીનીના રોજ જોહાનીશખમાંથી ગોટર
માં ડરખત આપ્યા હતા. રસ્તે
લેડીમીથ, ડંડી વિગેરે સ્થળોએ તેમના
માનમાં વિદાયગીરીના મેળાવડા થયા
હતા. તેમજ વીક એન્ડ દરમીયાન
ડરખત અને આજીવનના પ્રમણ્યા
ઓમાં પણ અનેક મેળાવડાઓ થયા
હતા.

નાટાલ ઇન્ડિઅન કેમિસ તરફથી
શ્રી મલહોત્રાના માનમાં વિદાયગીરીનો
મેળાવડો પ્રથમ સોમવારે સાંજને માટે
લોન રૂટીટપર આવેલા ગાંધી હોલમાં
ગોઠવાયો હતો. પરંતુ પાછળથી
સ્વીમર મંગળવારે નહિ પરંતુ સોમવારે
ઉપડવાની હોવાનું માહુમ પડતાં
મેળાવડાનું રથળ અને સમય છેલ્લી
ધરીએ બદલવા પડ્યાં હતાં અને
સ્વીમરે સાંજે સાડા ચાર વાગે ડરખત
ઇન્ડરનેશનલ કલ્ચરમાં મેળાવડો થયો
હતો. આ મેળાવડાને લઈને ઘણા
લોકો મેળાવડામાં હાજર થઈ શક્યા
નહોતા. તેમ છતાં કલ્ચરનો હોલ
પુરેપુરો ભરાઈ ગયો હતો. પ્રથમ

ડરખત એન્ડ ડિરેક્ટ વીમેન્સ લીમ
તરફથી આ નારનો તકવાર કરવામાં
આવેલો તેને સીએ ન્યામ આપ્યો
અને તે પછી કેમિસના પ્રમુખ ડા.
જી. એમ. નાયકરના પ્રમુખપણા નીચે
સળા મળી. શ્રી મલહોત્રાની તેમજ
હોદ્દા અને હોદ્દાના વડા પ્રધાન શ્રી
નેહરૂની પરદેશમાં વસતા કચડાએલા
લોકો પ્રત્યેની સેવાઓની પ્રશંસા
કરનારાં બાપજી થયાં ગાદ શ્રી.
મલહોત્રાએ પોતાના બાપજીમાં કહ્યું કે
મારા પાંચ વર્ષના અહિના રહેઠાણ
દરમીયાન મને ઘણું શીખવાનું મળ્યું
છે. હોદ્દા અને આવેલા હોદ્દાની
સ્થિતિ ઘણી કડકી થઈ પડે છે.
અહિના વર્ણવેલના કાયદાઓને લીધે
તેનું જીવન લગભગ અસભ્ય થઈ પડે
છે પરંતુ માત્ર હોદ્દાઓ નહિ પરંતુ
યુરોપીયન, આફ્રીકન અને કલડ
મીત્રોએ પણ મારાપર વર્ણવેલા પ્રેમ
ને લઈને માફ જીવન સુખ ચાંતીમાં
પસાર થયું છે જેનું સુખદ સ્મરણ
મને કાયમ રહેશે.

શ્રી મલહોત્રાએ કહ્યું કે હોદ્દાઓ
ના માનસમાં હું આપ્યો ત્યારના
કરતાં આજે ઘણો ફેર પડી ગયો છે.
એ વખતે હજી હોદ્દાઓ કેવળ પોતા
ની જ સ્થિતિનો વિચાર કરતા હતાં

અને આજે તેઓ આ દેશના સવળા
પીડીત લોકોનો વિચાર કરી રહ્યા છે
અને સંગઠીત થઈ આ દેશના અન્યાયી
કાયદાઓ સામે લડી રહ્યા છે.

શ્રી મલહોત્રાએ કહ્યું કે એપાર્ટહેંડ
ના રચનારોની નીતી બદલ થતા જતાં
છે કારણ એપાર્ટહેંડમાં નીતી રહી
નથી.

આ દેશના રાજકીયોએ એવું
બંધારણ ઘડ્યું છે કે જેમાં ગોરાના
હાથમાં સર્વોપરિતા રહેલી છે. હોદ્દાઓ
આ બંધીની સામે લડી રહ્યા હોવાથી
તેઓને પરદેશી અને ભેવદા ગણી
કાઠનામાં આવી રહ્યા છે. એવો
દાવો કરવામાં આવે છે કે દક્ષિણ
આફ્રીકામાં ડેમોક્રેસી છે. ડેમોક્રેસીને એક
ખાસ નીયમ છે કે અમુક વર્ગ સત્તામાં
ચુંટાય ત્યારે તેણે દક્ષિણ આફ્રીકાનું
હિત જોવું જોઈએ. જો તેમ ન કરે
તો જો આ ચુંટાએલા નથી તેઓ એ
વખતે વખોડી કાઢે.

દક્ષિણ આફ્રીકામાં કાયદા પસાર
કરવામાં એવી દલીલ કરવામાં આવે
છે કે ગોરા સુધારાનું રક્ષણ કરવામાં
આવે છે. દક્ષિણ આફ્રીકામાં ગોરા
સુધારાનો અર્થ ગોરાની સર્વોપરિતા
યાવ છે, જેને તિરસ્કાર, ભય, નીતી
બદલતા અને સંકુચિતતા વડે પોષવા

માં આવે છે. આવા ખોટા પાયાપર
સ્થાયેલા સુધારાનો નાશ થવો જ
જોઈએ.

માથુસની ચામડી ગોરી હોવાથી તે
હુમ્મ છે એ ખ્યાલને પકારની દુનીયા
વખોડી રહી છે.

લોકોને હો નહિ આપવાની પાછળ
પ્રેમભાવના નથી રહી. તેની પાછળ
બળબળી રહેલી છે કે જેને જામકી
કાયદો અણુમાં આવે છે.

શ્રી મલહોત્રાએ કહ્યું કે સરકાર
જાણે છે કે ખરાબ બંધોપર સારાં
બંધોનો વિનય થઈ રહ્યો છે અને
અંતે તેણે પોતાની એપાર્ટહેંડની
નીતી બદલવી જ પડશે.

શ્રી મલહોત્રાએ કહ્યું કે બીન-ગોરા
ઓની સામે ઘણી કપરી લડત પડેલી
છે અને તેઓને સરખાત અદ્યજો તો
નડરોજ પરંતુ આખરે તો તેઓનો
વિનય થશે જ કારણ સત્ય તેઓના
પક્ષમાં છે.

બીનનાં બાપજી કરનારાઓમાં આ-
ફ્રીકન નેશનલ કેમિસ (નાટાલ)ના
સેક્રેટરી મી. યેંગ્વા, કલડ લોકોની
સંરચના મી. હેનડી અને ડરખત
એન્ડ ડિરેક્ટ વીમેન્સ લીમનાં
મીસીસ મ્હીટી દતાં, મી. ઇરમાઇલ
મીરના પતિન શ્રીમતી શક્તીમા મીર
આબાર ડશોવનાઈ બાપજી કહ્યું હતું.



ફોન: ૨૪૮૪૫.

ઓસરી ક્યાંથી ખરીદશો ?

જો આપ સ્વચ્છ અને ભરોસાપાત્ર ઓસરી મેળવવાને ઈતિજાર હો તો અમારા ઉપર લખવા ચુકશો નહિ. હમે
જનતી અડપે, ચોકખો માલ, કિફાયત ભાવે મોકલાવશું.

“આહકાને સંતોષ આપવો” એ હમારો મુદ્દાલેખ છે.

એક વખતનો દ્રાયલ ઓરડર, આપનો વિશ્વાસ સંપાદન કરવાને અચુક ફળીભૂત થશે. કન્ડીના ઓરડરો ઉપર
સ-વિશેષ, કાળજીપુર્વકનું ધ્યાન આપવામાં આવે છે.

ગાંધીવદુ,

કડોળ,

ધર-ગથ્થુ દવાઓ,

હવન-પુળની સામગ્રીઓ.

સાડી-લુગડા,

લગ્નની પ્રત્યેક જરૂરીયાત.

કન્ડીના ઓરડરો સી. આ. ડી.થી મોકલાવવામાં આવશે.

ભારતનો પત્ર

(અમારા અખરપત્રો તરફથી)

મુજબ તા. ૨૦-૭-૫૪.

રાજકોટ શહેરમાં વચ્ચેથી અત્યાર સુધી રેલવે લાઇન પસાર થતી હતી. ત્રીજી ટ્રેનો આવતાં જતાં શહેરના વાહન વ્યવહારને અટકી જવું પડતું હતું. રાજકોટની વસતિ સાત ઓછી હતી, ત્યારે રેલવે લાઇન શહેરની વચમાં નાંખવામાં આવી હતી પરંતુ સૌરાષ્ટ્રનું એકમ થતાં રાજકોટની વસતીમાં અસાધારણ વધારો થયો. આરે તરફ પહેલાં સુધી મકાનો બંધાઈ ગયાં. વાહન વ્યવહારમાં પણ યુગ્મજ વધારો થયો. આને પરિણામે વચ્ચેથી રેલવે લાઇનને દુર કરવાની જરૂર ઉભી થઈ. એટલે રાજકોટ ટાઉન રેલવેથી કેટલાક અંતરે નવી રેલવે લાઇન નાંખવામાં આવી અને તેને રેલ ડોર્સની ઉપરથી ફરીને રાજકોટ જંકશન સુધી ઘડવામાં આવી છે. આ નવી રેલવે લાઇનનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને હવે ટ્રેનો એ માર્ગે આવે જાય છે. એટલે શહેરના વાહન વ્યવહારને રાહત મળી છે. નવી રેલવે લાઇન પર ભક્તી નમર નામનું ટ્રેશન રચાવવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં ફરી ભાવનગર-તારાપુર રેલવે બંધવા સામે જોરદાર પ્રચાર ઉપડ્યો છે. સૌ પોતે પોતાના મતનું સમર્થન કરે છે. કેાઇ વડોદરા રાજકોટ વચ્ચે ક્ષેત્રોગ્જ રેલવે બંધવાની માનણી કરે છે. તેો કેાઇ નીરમમમથી નવી લાઇન કાઢી જાનમનગર પાસે જોગણ સાધવાની માંગણી કરે છે. આમ ચોમેરથી નરી નરી માગણીઓ થઈ રહી છે. પરિણામે ભાવનગર-તારાપુર રેલવે બંધવાનું કામ હાલતરત તેો અટક્યું છે અને સૌ જો પોતે પોતાનો સ્વર્થ જોઇ પોતપોતાના વિસ્તારમાં ક્ષોડજો રેલવે નાંખવાની માનણી કરશે તેો તેમને તેો મોટી રેલવે નહિ મળે પણ કદાચ સૌરાષ્ટ્રને ભાવનગર-તારાપુર જોડણ્યુ મુમાવવતો પણ વખત આવે.

પાકીસ્તાનમાંથી ભૂપત અને તેના સાથીઓ પાછા ભારતમાં આવવાના સમાચાર પંજાબની પોલીસે આપ્યા હતા. ભૂપતને પાકીસ્તાનમાં કાંઈક વાંધા પડ્યાનું કહેવાય છે. પરંતુ સૌરાષ્ટ્ર પોલીસે તરતજ આ સમાચાર ખોટા હોવાનું જણાવ્યું હતું અને જાહેર કહ્યું હતું કે, પાકીસ્તાનમાં ઉઠાડાનું ભૂપત પરનો જાપો વધુ કડક બનાવવામાં આવ્યો છે. કચ્છમાંથી મળતા સમાચારો પ્રમાણે ભૂપતના સાથીદારો લખુ માંજરીઆ, કરીમ અને માલાને છૂપત સાથે વાંધા પડ્યો છે. એટલે

ભૂપતના આ સાથીઓ ભારત આવવાની કચ્છના હતા, પણ કચ્છના રણમાં ચોમાસાને લીધે પાણી બરાબેલાં હોવાથી સરહદ ક્ષોળખવાની ક્ષિમત કયાં વખરજ તેઓ સિંધમાં પાછા ફર્યા હતા. આમ ઉલટા-સુલટા હોવાને આવી રહ્યા છે. તેમ છતાં ભારતીય પોલીસ સરહદપર ચાંપતી તહેદારી રાખી રહી છે.

યુજરાત-સૌરાષ્ટ્રમાં બધે ઠેકાણે સારો વરસાદ પડ્યો છે. વાવણી ધર્મ ગઈ છે અને ખેડૂતોને સારા પાકની આશા છે. અનાજના ભાવો ઘટવા માંડ્યા છે. ભાવો ઘટતાં ખેડૂતોને ચિંતા ઘટી રહી છે.

પાકીસ્તાનથી આવેલા સિંધી નિવાસિતોને મોટો ભાગ બાંધવા વિસ્તારમાં વધ્યો છે. આ વિસ્તારમાં કોપડની એક મોટી મીલ કાઢવાનો સરકાર વિચાર કરી રહી છે. મીલ શરૂ કરવા માટે ભારત સરકારે રૂ. ૨૫ લાખ આપવાનો નિયુધ્ય કર્યો છે.

કચ્છનું કંડલા બંદર, જે કશાનીની ખોટ પુરી પાડશે અને ઉત્તર ભારત માલ આપાત કરવાનું મુખ્ય બાંધે બની રહેશે, તેનું બંધકામ ૧૯૫૪માં પુરું થવાનું હતું, પરંતુ હવે તે ૧૯૫૬માં પુરું થઈ જશે એમ કંડલા બંદરના મુખ્ય ઇન્જનેરે જાહેર કહ્યું હતું.

વિધની લાંબામાં લાંબી બાખરા નહેરોનું ઉદ્ઘાટન ખેડૂતોના હર્ષના પોકારો સાથે ભારતના વડા પ્રધાન શ્રી નેહરુના હસ્તે થયું. આ નહેરોના ઉદ્ઘાટનથી પંજાબ, પેશ્વ અને રાજસ્થાનમાં આપાડોનો એક નવો યુગ શરૂ થાય છે. ભારત સરકારે દેશના આર્થિક વિકાસ માટે હાય ધરેલી યોજનાઓમાં બાખરા યોજના સૌથી મોટી અને વધુ મહત્વાકાંક્ષી છે. હકીકતમાં વિખબરમાં બીજે કયાંય આવડી જંગી બહુકક્ષી યોજનાને અમલ થઈ રહી નથી. આ યોજના તેો પ્રથમ વિચાર ૧૯૦૮માં એ વખત ના પંજાબના અવનર સર જુહા ઉર્લાને આપ્યો હતો. પરંતુ તેનો અમલ તેો ભારતના ભાગલા પડ્યા એ પહેલાં ૧૯૪૬માં શરૂ થયો હતો. જો કે જોરદાર રીતે કામ તેો એક ૧૯૪૮માં હાય ધરવામાં આવ્યું હતું. નહેરોનું બંધકામ ધાર્યો કરતાં એક વર્ષ વહેલું પૂરું થઈ ગયું.

બાખરાનાંગલ યોજના તરીકે જાણખાતી આ યોજના નીચે પ્રમાણે છે:

સતલજ નદી ઉપર ૧૮૦ ફુટ ઉંચાં સીમેન્ટ કોન્ક્રીટનો સીધો બંધ બંધવો. આની પાછળ રૂ. ૧૪૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ બંધની લંબાઈ ૧૭૦૦ ફુટની હશે. તેની ઓછામાં ઓછી પહેળાઈ ૧૨૫ ફુટ હશે. નદીમાં બારે પુર આવે ત્યારે બંધ અને દરવાજાને બચાવવા માટે પુરનાં પાણીને વચ્ચેથી વહી જવા દેવા માટે પણ જોખવાઈ છે. બંધ માંથી નહેરોમાં પાણી લઈ જવા માટે કુલે દસ-દસ દરવાજાના બે ટીઅરો રહેશે. બાખરા બંધના પાણીમાંથી વિજળી ઉત્પન્ન કરવા માટે ૯૦ હજાર કીલોવોટની શક્તિવાળા ૧૦ જનરેટરો નાંખી શકશે. બાખરા બંધથી રચાનારા તળાવમાં ૭૪ લાખ એકર ફુટ જેટલું પાણી રહી શકશે. આ તળાવ ગોર્લેદસાગર તળાવ તરીકે જાણખારો. તે પચાસ માર્કલ લાંબુ હશે અને બંધ પાસે તેની પહોળાઈ ૩ માઇલની હશે. આવો જંગી બંધ બાંધી શકાય એ માટે ડુંકે સમય સાર સતલજના પાણીને બીજે રસ્તે વાળવાની જરૂર ઉભી થઈ હતી. એટલે નદીની બંને બાજુ પચાસ ફુટના વ્યાસવાળા અને અધો માઇલ લાંબા જંગી જુગદા ઉભા કરવામાં આવ્યા છે. આ જુગદા મારફતે નદીના પ્રવાહને વાળવામાં આવશે. એટલે બંધની જગ્યાએ નદીનો પટ ઠોરો થતાં ત્યાં બંધકામ થઈ શકશે. આ બંધનું કામકાજ ૧૯૫૬માં પુરું થવાની ધારણા છે.

બાખરા બંધની નીચે ટાં માઇલ દુર બીજે નાંગલ બંધ બંધવામાં આવ્યો છે. નાંગલ બંધનું બંધકામ પુરું થઈ ચુક્યું છે. આ બંધથી નદીની સપાટી ૫૩ ફુટ ઉંચી આવશે. તે બાખરા બંધમાં પાણીની વધવટને સમાવવા માટે એક રીઝરવોયર (તળાવ) ઉભું કરે છે. આ નાંગલ બંધને કારણે નાંગલ તળાવ ઉભું થતાં ઘોષ માર ધસી આવતી સતલજનું બળ અહીંથી નરમ પડી જાય છે અને તે નરમ બનીએ વહે છે. બાખરાની નહેરો આ બંધમાંથી પાણી ગેળવે છે.

બાખરાની મુખ્ય નાંગલ-હાઇડલ નહેરની લંબાઈ ૪૦ માઇલની છે. અને તે સીમેન્ટ અથવા તેો ટાઇલ્સથી બનેલી છે. કાદવ-કચરો દુર કરવા માટે નદીમાં એક્સકલુડર મુકવામાં આવેલ છે. એટલે આ બંધમાંથી સ્વચ્છ જળજ નહેરના ૧૨મા અને ૧૮ મા માઇલ પર મુકવામાં આવેલા વિજળીના પાવર હાઉસોમાં જશે. ડુંગરાળ જમીનમાંથી આ નહેર બિાદવામાં આવી હતી. કેાઇ કેાઇ ઠેકાણે ૮૦ ફુટના ખાડા પુરવા પડ્યા હતા જ્યારે કેટલેક ઠેકાણે સો ફુટ ઉંચાં માત્ર કાપવો પડ્યો હતો એ હકીકત પરથી આ કામની કડીનતાનો ખ્યાલ આવી શકશે. હાંડી ઇન્જનેરોએ કુશળતાથી બગીચ કામ પુરું કહ્યું હતું.

મુખ્ય નહેર પર ૧૨ માઇલ ઉપર ગંગવાલ પાવર હાઉસ છે અને ૧૮માં માઇલ ઉપર ઠાટલા પાવર હાઉસ આવેલ છે. હાલને તબક્કે આ બંને પાવર હાઉસો ૪૮-૪૮ હજાર કીલો વોટ જેટલી વિજળી ઉત્પન્ન કરશે. મંગવાલ પાવરહાઉસ આવતા મહિના માંજ તબક્કા ઘટ જશે જ્યારે ઠાટલા પાવર હાઉસ આવતા વર્ષના અંતમાં કામ કરતું ઘટ જશે.

બાખરાની મુખ્ય નહેરમાંથી શાખાઓ નીકળે છે. તેની કુલ લંબાઈ ૬૭૭ માઇલની છે. આ શાખાઓમાંથી વહેંચવા માટે બંધાયેલી વહેંચણી નહેરોની લંબાઈ ૩૯૫૮ માઇલની છે. આ નહેરની નીચેથી આડા આવતા વહેણોને કાઢવા ૪૮ જગ્યાએ બંધકામ કરવામાં આવ્યા હતા. નહેરના માર્ગમાં રસ્તાઓ માટે ૨૫૦ પુલો અને રેલવેના કોર્સો માટે ૧૭ પુલો બંધવામાં આવ્યા હતા. લગભગ કરોડ ધન વાર જેટલું ખોદકામ કરવામાં આવ્યું હતું.

આ મોસમ પુરતું તેો સતલજમાં આવતા પુરનાં પાણી જે નકામ દરિયામાં વહી જાય છે, તેને નાંગલ તળાવમાં અટકાવીને તે વાટે આ નહેરોને પાણી અપારો. સતલજના ચાલુ પાણીને ઉપયોગ નહિ થાય. આ નહેરોથી ૩૫,૨૦,૦૦૦ એકર જમીનને પાણી મળશે. એથી, ૧૧, ૩૦,૦૦૦ ટન જેટલું વધુ અનાજ ઉત્પન્ન થશે અને એથી દેશને આપાત પાછળ ખર્ચવા પડતા રૂ. ૬૦ કરોડ બચી જશે. પંજાબ, પેશ્વ અને રાજસ્થાનમાં આ નહેરોથી અનાજનું ઉત્પન્ન વધવા સાથે ૪૦ ટકા જેટલી જમીનમાં લાંબા તારના રૂતું વાવેતર થશે. લાંબા તારના રૂતી ભારતને આપાત કરવી પડતી હતી, તે હવે અહીં લગભગ ૮ લાખ ગાંસડી જેટલું થશે. એથી ભારતને રૂ. ૩૦ કરોડનો ફાયદો થશે. આખી યોજના પુરી થઈ જતાં લગભગ ૬૦ લાખ એકર જમીનને નહેરોનું પાણી મળશે. એટલે એ પછી આ વિસ્તાર ભારતનો ધાન્ય બંધાર બની જશે. આશરે ૪ લાખ કીલોવોટ જેટલી વિજળી ઉત્પન્ન થશે અને આ પ્રદેશના ગ્રામ વિસ્તારો ઉપરાંત એક દિલ્હી સુધીના ૧૨૮ શહેરોને તેમાંથી વિજળી મળશે. ઉત્પન્ન અને વિજળી વધવાને પરિણામે આ વિસ્તારમાં ઉભા થનારા નરોમાં પચીસ લાખ માણસોને કામધંધો મળશે.

બાખરાની નહેરોમાં સતલજના પાણી વહેતા મુકવાની અને આ યોજના પ્રગળને અર્પણ કરવાની વિધિ કરતાં શ્રી નેહરુએ ૨૫૯ પહે જણાવ્યું હતું કે, આ નહેરોમાં હાલ પુરતું તેો પુરતું પાણી વપરાશે અને તેની ભારત તરફથી પાકીસ્તાનને અપાતાં સતલજના પાણીપર અસર નહિ થાય.

ભારત પાકીસ્તાનને તુકસાન કરવા ચાહતું નથી, તેમ છતાં પાકીસ્તાનને કારણે ભારત પોતાની વિકાસ યોજનાઓને અટકાવી શકે નહિ અને અટકાવશે પણ નહિ એવી ચેતવણી તેમણે આપી હતી. તેમણે વિશ્વમેક નો ચુકાદો સ્વીકારી લેવાની પાકીસ્તાનને અપીલ કરી હતી.

આમ છતાં પાકીસ્તાને બાખરા નહેરો ખુલ્લી ચુકવા સામે બારે ઉઠા પોઠ મચાવ્યો છે. ભારત સામે પુનો માં પચમાં લેવાથી માંડીને લગભગ બહેર કરવા સુધીની માગણી પાકીસ્તાનના અખપારો અને નેતાઓ દ્વારા થઈ છે. પરંતુ ભારતના રાજદ્વારી મંડળોએ આવી કાંઈ ધમકીની સાવ અવગણના કરી છે અને શાંતિ ગિતો પોતાનું કાર્ય ચાલુ રાખ્યું છે. તેમના કહેવા મુજબ, પુ. પાકીસ્તાનમાંથી સુરક્ષા લીધેલી જડ ઉપક્રી અથવા પછી પશ્ચિમ પાકીસ્તાનમાં પણ લીગ ની એવી દયા થવાની શિયતિ સર્જાઈ રહી છે. લોકોના આર્થિક વિકાસ માટે સુરક્ષિત લીગે કોઈ કાર્યક્રમ તકવાર કર્યો નથી અને હજી સુધી પાકીસ્તાનના અંધારણના સિદ્ધાંતો પણ નકકી કર્યાં નથી. એટલે પ્રજામાં પ્રવર્તતા અસંતોષને તે ભારત તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેમાં તેને કાંઈ સફળતા મળે તેમ લાગતું નથી.

પાકીસ્તાન સરકારે ભારત સરકાર પાસે બાખરા નહેરો ખોલવા સામે "સખત વિરોધ" નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે, આ નહેરો ખુલ્લી ચુકવાથી વિશ્વ બેકનો ઉપક્રમે વાટાઘાટો શરૂ કરવા સમયે ૧૯૫૨માં થયેલ શિયતિના કરેલા કરારનો ભંગ થાય છે. વધુમાં હવે તે કહે છે કે, વિશ્વ બેકનો ચુકાદાને તેણે અસ્વીકાર કર્યો જ નથી અને હજી તે તેના પર સર્વોચ્ચ વિચારણા અને વાટાઘાટો ચલાવવા ચાકે છે અને વોર્સીંગનમાં હજી વર્કીંગ પાર્ટીની ત્રીપક્ષી મંત્રણા ચાલુ છે.

૧૯૫૨ના માર્ચમાં વિશ્વ બેકનો નિષ્ણાતો તથા ભારત-પાકીસ્તાનના ધજનેરોની એક વર્કીંગ પાર્ટી રચવામાં આવી હતી. આ વર્કીંગ પાર્ટીએ ભાતે નહેર વિસ્તારોમાં જાહેર તપાસ કર્યાં ઉપરાંત ભારત અને પાકીસ્તાન અને તરફથી તેની પાસે પોતાપોતાના દાવા રજૂ કરવા થોડા બંધ કામગીરી આ રજૂ કરવામાં આવ્યા હતા. તેના પર લાંબી વિચારણા કર્યા પછી જ બેકે સતલજ સહિત પૂર્વ બાણુની ત્રણેય નદીઓનાં પાણી પર ભારતને સુવાંમ દકક આપનો ચુકાદો આપ્યો છે. વિશ્વ બેકમાં ગોરા ભાગની સુધી અને મોટા ભાગના અધિકારીઓ અમેરીકન છે. તેના ચુકાદાથી ભારતને રૂ. ૪૦ થી ૬૦ કરોડ નકામા પાકીસ્તાનને

આપવા પડે એમ હતા. છતાં તેને આ પ્રશ્નો કાઢી રીતે નિકાલ યતો હોય તો કરવો એમ ધારીને ભારતે આ ચુકાદો માન્ય રાખ્યો હતો. ભારત સરકારે સાફ જણાવ્યું છે કે, પાકીસ્તાને વિશ્વ બેકનો ચુકાદો ન સ્વીકારતાં એ વાટાઘાટો પુરી થાય છે અને ૧૯૫૨ના કરારને પણ અંત આવે છે. હવે જો પાકીસ્તાન રીકાંતિક રીતે બેકના ચુકાદાનો સ્વીકાર કરે તો જ એ ધોરણે ભારત કરી વાટાઘાટો કરવા તકવાર છે. એ દરમિયાન ૧૯૪૮ માં ભારત-પાકીસ્તાન વચ્ચે નહેરોનાં પાણી અંગેના કરારો ચાલુ રહે છે અને એ કરાર પ્રમાણે ધીમે ધીમે ભારતે પાકીસ્તાનને સતલજના પાણી આપવાનું બંધ કરવાની જોગવાઈ છે.

ચાલુ મોસમમાં પાકીસ્તાન ચેનાળ નદીમાંથી પાણી લઈ જવા માટે તેણે વાંધેલા બાવોઝી-સુલેમાનકી હેડ વર્કીસ

મારફતે સતલજમાં નેટલું પાણી લાવી શકે છે, તેનાથી પણ જોઈ પાણી ભારત બાખરા નહેરોમાં વાળશે. એટલે આ નહેરોથી પાકીસ્તાનની ખેતિને જરાય તુકસાન નહિ થાય. એક વર્ષના મળામાં તે ચેનાળમાંથી વધુ નહેરો ખોલીને સતલજમાં વધારાનું પાણી લાવી શકે છે.

કુદરતની કૃપા અને આવા વિકાસ કાળોને કીવે ભારત અનાજની ખામત માં રવાજી થઈ ગયું છે. હવે તેને અનાજ આપાત કરવ ની જરૂર રહેતી નથી. સરકાર પાસે પંદર લાખ ટન અનાજ ભેગું થઈ ગયું છે. અનાજ ઉપરના તમામ અંકશો ઉઠાવી લેવામાં આવ્યા છે. એ પછી હવે અનાજના ભાવો અડગા માંડવા છે. તેથી ખેડુનેને ચિંતા થઈ રહી છે.

વિવિધ ખબરો

ઈસ્ટલંડન હીંદુ સોસાયટી

ઈસ્ટલંડનના હીંદુ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન મહાભારતની કથાનું વાંચન યોજવામાં આવેલ છે. કથા શુક્રવાર તા. ૩૦મીની સાંજે ૭ા વાગ્યે હવન પ્રાર્થનાથી શરૂ કરવામાં આવી હતી. દર સોમવારે, શુક્રવારે અને રવિવારે કથાનું વાંચન રાતના ૭ા વાગ્યાથી ૯ા વાગ્યા સુધી ચાલે છે.

ગુજરાતી ભાષા બહેનો તેમજ બાળકો ને હીંદુ ધર્મના આ પવિત્ર માસ દરમિયાન આ કાર્યક્રમમાં ભાગ લેવા સંસ્થાના મંત્રીઓ તરફથી આમંત્રણ આપવામાં આવે છે.

યુવક મંડળ (પોર્ટ એલીઆબેથ) પોર્ટ એલીઆબેથ યુવક મંડળની

વાર્ષિક ચુટણી સભા રવિવાર તા. ૨૫-૭-૫૪ના રોજે શ્રી ગુજરાતી સભા ભવનમાં શ્રી મણીલાલ રણછોડજીના પ્રમુખપણા હેઠળ મળી હતી.

પ્રમુખશ્રીના આવકાર પ્રવચન પછી મંત્રીજી તરફથી મંડળના કાર્યનો હેવાલ રજૂ થયો હતો, અને ખજાનચીએ સંસ્થાના આવક જલકને હિસાબ રજૂ કર્યો હતો. પ્રકાશન વિભાગ તરફથી યુવક સામયીકનો તેમજ શીલમ (સીને-માં) સમિતિ તરફથી ફેવાલો રજૂ થયા હતા. ત્રણે હિસાબ અને હેવાલો સર્વાંગુમતે પાસ થયા હતા. મંડળની જુરિ જુડી પ્રતીઓ દ્વારા મંડળે ઘણી પ્રમતી સાધી છે. તે માટે પ્રમુખ શ્રીએ અને અન્ય સભ્યો તરફથી દરેક વિભાગના કાર્યકરોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

ને પછી નવા કાર્યવાહકોની નીચે મુજબ ચુટણી થઈ હતી: પ્રમુખ: શાંતીલાલ વાંસદા, ઉપ-પ્રમુખ જોડુ ભાઈ ડાહ્યાભાઈ, જોડવા મંત્રીઓ: યુનીલાલ કુલ્લભભાઈ અને નગીનલાલ ભાણુભાઈ, ખજાનચી: હમનલાલ ભાણુભાઈ, ઓડીટર: ઘેડુભાઈ રજુ પ્રિંડજી. કમીટી સભ્યો: ઘેડુભાઈ રણછોડજી અને હખીલલાલ ટલાટી, શીલમ કમીટી (સીનેમાં): શાંતીલાલ વાંસદા, જમજીવનલાલ રતનજી, રમજી લાલ ભાણુભાઈ, પ્રાણજીવનભાઈ ભમવાનજી, શાંતીલાલ નારણભાઈ લખપુ. લગ્નની ખુશાહી

લુઈસટીપાર્ટના જાણીતા વેપારી શ્રી મણીલાલ કે ચુંદરજીનાં પુત્રો ખેન મંડુલાના લગ્ન રોસેનો આરસીવાના જાણીતા વેપારી શ્રી મનમલાલ લાલજી રામચુરાના પુત્ર શ્રી શાંતીલાલ સાથે લોરેન્સો માર્કિસમાં ઘણી ધામ ધુમથી તા. ૬-૭-૫૪નાં થયાં હતાં. ૩૨મન જોહાનીસખર્ગ, પ્રીટોરીયા તથા લુઈસટીપાર્ટથી ઘણા સમા રોહીઓએ તે પ્રસંગે હાજરી આપેલ. શ્રી મણીલાલ ઘણા વખત થયા કુટુંબ સાથે મુંબઈ હતા પણ આ પ્રસંગ માટે જ દેશથી આવેલ. લગ્ન પ્રસંગને અંગે લોરેન્સો માર્કિસના સગારનેહી તેમજ સ્થાનિક મીન મંડળે ઘણા જ ઉત્સાહથી હાર્દીક સાથે આપેલ અને આખો ઉત્સવ ધણા જ સંતોષથી પાર ઉતરેલ.

કુટુંબજાનક અવસાન લગ્ન બાદ શ્રી મણીલાલ સહકુટુંબ લુઈસટીપાર્ટ ગયા અને ત્યાં એલીમ હોસપીટલમાં તેમના પતિ - શ્રીમતી તારાબેનનું ગળાનું ઓપરેશન કરાવતાં શ્રીમતી તારાબેનનું તા. ૨૬-૭-૫૪ના અવસાન થયું. તેઓ તેમના ત્રણ બાળકોને દેશમાં મુકીને આવેલ. મરનાના આત્માને ત્રણ શાન્તી આપે અને સ્વર્ગસ્થના કુટુંબીજનોને ધીરજ અને હીંત આપે.

બે અઠવાડીક પંચાંગ

વાર	ખ્રીસ્તી ૧૯૫૪ ઓગસ્ટ	હીંદુ ૨૦૧૦ શ્રાવણ	મુસલમાન ૧૩૭૩ ઇસલંબ	પારસી ૧૩૨૩ ફરવદીન	સુર્યોદય ક. મી.	સર્પોસ્ત ક. મી.	ધાર્મિક તહેવારો-ઉત્સવો
શુક્ર	૬	૨૬	૬	૯	૬-૩૬	૫-૨૩	ગયે અઠવાડીકે ભૂલથી પારસી ફેવેનર માં કદીમી સાસની તારીખો છપાઈ હતી. પુસ્તાક એકાદશી. ફૂંબાઈમી પંચક. નાળીયેરી પૂર્ણિમાં (ખજેવ) પંચક. કિંદ રવાતનાં દિન.
શનિ	૭	૨૭	૭	૧૦	૬-૩૮	૫-૨૪	
રવિ	૮	૨૮	૮	૧૧	૬-૩૮	૫-૨૪	
સોમ	૯	૨૯	૯	૧૨	૬-૩૮	૫-૨૪	
મંગળ	૧૦	૩૦	૧૦	૧૩	૬-૩૭	૫-૨૫	
બુધ	૧૧	૩૧	૧૧	૧૪	૬-૩૭	૫-૨૫	
ગુરુ	૧૨	૩૨	૧૨	૧૫	૬-૩૭	૫-૨૫	
શુક્ર	૧૩	૩૩	૧૩	૧૬	૬-૩૬	૫-૨૬	
શનિ	૧૪	૩૪	૧૪	૧૭	૬-૩૬	૫-૨૬	
રવિ	૧૫	૩૫	૧૫	૧૮	૬-૩૬	૫-૨૬	
સોમ	૧૬	૩૬	૧૬	૧૯	૬-૩૫	૫-૨૭	
મંગળ	૧૭	૩૭	૧૭	૨૦	૬-૩૫	૫-૨૭	
બુધ	૧૮	૩૮	૧૮	૨૧	૬-૩૫	૫-૨૭	
ગુરુ	૧૯	૩૯	૧૯	૨૨	૬-૩૪	૫-૨૮	

તાણુ ઉમદા ફ્રુટ

“ફરબનનું” ટકાઈ આડું ૨૦ પેની રતલ, મોટી કલીનું લસણુ શી. ૧-૬ રતલ.

સુરણુ, રતાણુ, આંખા દળદ, લીલી દળદની મોસમ આણુ યદ છે. કપુરી અને ચેરલી પાન ૫/- રતલ, મોસ્ટેજ ગુદું, ગોળ આસપીટ ૧૦/૬, લાંબી અને રક્વેર આસપીટ ૧૬/૦ ડઝન. હમો ચોખા, દાળ વિગેરે દરેક જાતની ઓસરી અને મસાલો રાખીએ છે.

રોડેશીઆ, ન્યાસાવેન્ડ અને બેલજીયમ ડાન્ગોના ઓરડરો પર પુરતું પાન આપી ડાઇ પચુ વસ્તુ પરમીટ કઠાવીને મોકલ્યું.

A. KADER & Co., (PTY) LTD.
WHOLESALE FRUIT MERCHANTS
P O Box 251. DURBAN.

એટલું તમે જાણો છો કે કેનેડાની વિશ્વ વિખ્યાત કંપની

સન લાઇફ ઓફ કેનેડા

હવેરાકત કંપનીના હમો સત્તાવાર એજન્ટ છીએ.

ઉપરાંત

દક્ષિણ આફ્રીકાની તરિખ અદાલતની કેપ ઓફ ગ્રેડ હોપ પ્રોવીન્સીયલ ડીવીઝન ના સરકાર તરફથી નીમાયેલા અંગ્રેજી તથા ગુજરાતી ભાષાન્તરકાર છીએ તેમજ અનેની ઈમીગ્રેશન અંગેનું કોઈ પણ જાતનું કામકાજ વિના વીલંબે ત્વરિત ગરીએ થઈ શકે છે.

1. Wherever there is a particular Life-Assurance Problem a Sun Life of Canada Plan can solve it.
2. Prompt settlement of claims is a maxim of the Company's Management.
3. During 1953 the Company paid over £31,000,000 to annuitants, policy holders and their families.

The Sun Life of Canada is a Leader in World Wide Assurance.

Consult us first.

C. C. PALSANIA

GENERAL AGENT

Business, Estate, Financial, Insurance and Immigration Consultant.

Sworn Translator.

100 Sir Lowry Road,
P.O. Box 4624.

CAPETOWN
Phone 3239D

હંસરાજ મોરારજી પવિત્રકે સ્કુલ

અંધેરી, મુંબઈ. (આશ્રમિક શાળા)

★ જીવન અને નવેગ્યરમાંથી સંસ્કારનું નવું સ્ત્રવ શરૂ થાય છે ★

• એશ્રમિક ૧૫૪ થી નવા છાત્રોનો સ્વીકાર કરવામાં આવશે • અનુભવી અને કાર્ય કુશળ શીક્ષકો, મશાસન કાર્ય હદતાવાળા, ખાણ કળીખાણ હોદ્દા હાઇ-સ્કુલના ભુતપુર્વ આચાર્ય.

વિશાળ કીટંગણુ, અદ્યતન સમગમવનાં સાધનોથી સંપન્ન વ્યાયામશાળા ભાષાશાળા, આધુનિક સંગવટ વાળો નર્ચન રવાનકુંડ, ઘોડેરવારી, બધીજ મનોહરક પ્રદર્શિઓની સમવટ, અદ્યતન સંગવટવાળા છાત્રાલયો, પોષ્ટીક યોગાઈ આપતું યોગાણું ભોજનશુદ્ધ, નાટ્યમંદિર, વ્યક્તિમત દેખરેખ. ‘મિટ્રન’ નર્સ અને ડોક્ટરની સંભાળ.


વાલ્કવશયુને ગુજરવતો અને સવટ હવાની સુરખી અર્પતો મહાસાગર ન્યાતજાતના લેહમાવ વિના બિનછાત્રોને (ટે સ્કોલર્સ) પણ અવેશ આપવામાં આવે છે.

વધુ વિગત માટે જાણો :

આચાર્ય કે. એસ. તલપટે, એમ. એ., અંધેરી, મુંબઈ.
ટેલીગ્રામ: 'RAJHANS' ફોન: ૮૧૪૧૭.

K.M. Lodia & Co.

Manufacturing Jewellers and General Dealers



22 ct Jewellery made to order in latest designs

આવિસ કેરટ

સોનાના હાગીના ખાસ અમારી જાતી દેખરેખ નીચે અમને અપાયકું કામ સંતોષ પામે એવી રીતે કરીએ છીએ.

નેકલેસ, જુદી જુદી ઢીઝાઈનની યંગડી અછોડા, સાડીની પીન, વીડી બકલક જોરોંગ વીગેરે બનાવીએ છીએ.

106 Prince Edward Street, Durban.

ગુજરાતી ધર્મપ્રેમી બન્ધુઓ માટે

	શી. નો.
તુલસીકૃત રામાયણુ ભાગ ૧ અને ૨	૬૫ ૦
શ્રી મનુસ્મૃતિ (૮૦૦ પાનાનું દળદાર પુસ્તક)	૧૩ ૦
સાચું સ્વર્ગ (પદિઆર કૃત)	૧૧ ૦
પ્રભુમય જીવન	૩ ૯
જન્મ અને નામ સ્મરણુ (જન્મ માટે ઉપયોગી પુસ્તક)	૪ ૯
નિત્ય પાઠ (વિવિધ દેવ દેવીઓનાં સ્તોત્રો)	૩ ૯
શ્રીમદ્ બગવદ્ગીતા	૪ ૯
રામનામ બજન માલા	૪ ૯
આશ્રમ બજનાવલી	૪ ૯
ગીરોબાઈના બજનો	૨ ૯
નરસીંહ બજનો	૨ ૯
ધર્મ શિક્ષા પાઠાવલી ભાગ ૧-૩.	૭ ૬
કંઠાવલી ભાગ ૧-૨	૭ ૬
અવણુ અને દશરથ	૧૦ ૬



હંમોશ અપકંઈ લાઇઓ માટે આ પુસ્તકો ખાસ મંગાવવામાં આવ્યા છે. ફરેક પુસ્તકોના પોસ્ટેજ માફ.

Obtainable at :

BHARAT MUSIC SALOON
AND BOOKSELLERS

(Corner Grey and Lorne Streets)

286 Grey Street,
DURBAN.

Phone: 26070

Phone 22905 Tel. ADD.: "GANDABHAI"

**The Home Of
INDIAN SWEETMEATS.**

G. C. Kapitan & Son

Vegetarian Restaurant

Upcountry customers are requested to send their cheques with their orders.

Write For Price List.

स्वादिष्ट मीठाईतुं जालीतुं मथक

अहारात्मना माहोळी ओरडर साथे येक मोहकवा महेरवानी करवी.

प्राधस लीस्ट मंगावो

**154 GREY STREET,
DURBAN.**

PHONE 33-2651

MASTER BROS.
(PTY) LTD.

MANUFACTURERS OF LADIES' & GIRLS' STRAW & FELT HATS
WHOLESALE MERCHANTS & DIRECT IMPORTERS

HOUSE FOR KEEN CASH PRICES
33 West Street, JOHANNESBURG.

मास्टर ब्रदर्स (प्रो.) लीमीटेड
होल्सेल मरचन्ट्स अन्ड डायरेक्ट इम्पोर्टर्स
रेडीमेड स्ट्रॉव हापड, डुबल रब्स. प्लानेट्स—प्रो नानो माटे
लत लतनो मात. तेगळ इंप्रीजन न्योरलेट साडीमे
नीगेरे माटे हमादे लां प्रयग वपास करवा मलामणु छे.
33 वेस्ट स्ट्रीट, जेहाननीसबर्ग.
फोन: 33-2651

धीइबाई पी. नायक

युसाइरी. धीमानां अने जनरल अेजन्ट

हॉइरतान अमर इनीयाना कोर्ष पक्ष बागनी हवाई हरियाई अमर नमीन
भागें युसाइरी करवा धरे वेळा अमारी मारुते युडीम हरे.
अंइगी, आग, यारी, डुब्लड, अकरमात, रेडोअसास, विगेरेना नीगा अये
हतरानी आपीजे छीजे.

ईन्डप्टेकस, परसनल टेकस, डिझालना योपडा वभावना रेवन्यु हवीयरन्स
सर्टीफिकेट के वेगारना सावसेन्से पासपोर्ट तेमळ इम्प्रियेशनने हपडी
जालतोमां हंई पक्ष डी लीधा बिना अये मरुत सलाह आपीजे छीजे.
नेशनल म्युस्युअल साईड् अेसोसिएशन जोइ अोरु वीया, योईसायर
ईनरयुरन्स कंपनी लीमीटेडना प्रतिनिधि.

Phone : 33-9033. 29e Commissioner Street,
JOHANNESBURG.

धी न्यु हिल युश-स्वीट माट

मेनेजर: मणीबाई बाणुबाई मारीपोरवावा.

इरेक लतनी मीठाईमे, योअभा धीनी तेमळ मेळा मेवा,
मसालाथी अये जनापीजे छीजे.

अमाइ वणव्याजेछुं सुरती लुछुं सेव, मसवा, गांठीला, वाछणां,
पातरां विगेरे इरेडोव ताल जनापीजे छीजे.

पार्डी वीगेरे माटे मोटा अमाळुमां मीठाई जोड'र अमाळे हंके
वअतमां जनापी आपीशुं.

PHONE 33-6675. P. O. BOX 3680.
THE NEW DIL-KHUSH SWEET MART,
34 President St., Corner Diagonal Street.
JOHANNESBURG.

तंडुरस्ती अने शक्ति माटे
आ शियाजामां मेथीपाक जाओ
शी. १२-६ रतल.

आजे न ओरडर करो:

केपीटन्स जाल्कनी होटेल
(धी कोर्नर मीठाई हाउस)

अे अने विकेटोरीया स्ट्रीटना युध्यापर - डरजन.
फोन नंअर २३४१४ रेडीमाम: KAPITAN.

NATHOO TABHA
TIMBER & HARDWARE MERCHANT
& DIRECT IMPORTER

Door, Windows, Corrugated Iron, Cement,
Mouarch, Iron Duke, Buffalo, and Elephant
brands paint or any other building material
at reasonable price.

Established 1907, NATHOO TABHA,
107 Queen Street, Phone 24647.
Telegraph "Mani," DURBAN.

करनीयर! करनीयर!! करनीयर!!!

विडुम सुद, अर्धनीअड्य सुद, वेल्डिंग, डरेसिंग वेस्ट,
साईड जोड' ओहीस डेस्ट, लुक केस, टेपल, तदन प्रीक्षायव
बावे मरीडी शकरी. लते पधारी लाज वेवा सुकरी नबि.

—जोकेस, टेपल अने डीयन-डरेसर—

अे हमादी रेअरेम नीये तर्हयार याग छे. तेनो स्टोळ हमेला वर्ड-
यार रहे छे. याग रेकडा बावोना प्राईस लीस्ट मंगानो अने वेपार
आगल वधारे.

L. MISTRY
51 BREE STREET, BURGERSDORP, J'BURG.
PHONE 33-4691. BOX 2526.